



## સુરત મહાનગરપાલિકા

### વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ

આર. ટી. આઈ. એક્ટ - ૨૦૦૫

પ્રો. એક્ટટીવ ડીસ્કલોગર

૨૦૨૧

(તા. ૧૬/૧૨/૨૦૨૧ ની સ્થિતીએ)

ઓફિસ :-

મસ્કતિ હોસ્પિટલ, ત્રીજો માળ,  
ટાવર રોડ, સુરત મહાનગરપાલિકા,  
સુરત-૩૯૫ ૦૦૩.

જંતુનાશક અધિકારી  
અને જાહેર માહિતી અધિકારી  
વી.બી.ડી.સી. વિભાગ  
સુરત મહાનગરપાલિકા.

## કલમ-૪ (૧) (ખ)(૧)

### પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો : -

- સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

## કલમ-૪ (૧) (ખ)(૨)

### પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો : -

#### જંતુનાશક અધિકારી : -

ભારત સરકારશ્રીનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત નેશનલ નોડલ સંસ્થા એન.વી.બી.ડી.સી.પી. અને એન.સી.ડી.સી.ની તથા રાજ્ય કક્ષાએથી વેક્ટર બોર્ડ ડિસ્ટ્રિક્શની ગાઈડલાઈન, માર્ગદર્શક સુચનો અનુસાર શહેરી વિસ્તારો માટે વાહક જન્ય રોગ નિયંત્રણની કામગીરી ડે.કમિશનરશ્રી(હેલ્થ અને હોસ્પિટલ) તથા આરોગ્ય અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન મુજબ તાંત્રિક અને વહીવટી બાબતો અંગે આયોજન, અમલીકરણ, દેખરેખ અને માર્ગદર્શન મુજબ કામગીરી કરવાની રહેશે.

- ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રી તરફથી યોજાતી મિટીગો, વર્કશોપ તથા કાર્યશિખીરોમાં હાજરી આપવી અને તેમની ગાઈડલાઈન અનુસાર વાહક જન્ય રોગ નિયંત્રણની કામગીરીનો વખતો વખતના સુધારાત્મક નિતીઓ, અભિગમો વગેરેનો અમલ કરાવવો.
- શહેરી વિસ્તારોમાં વાહક જન્ય રોગોનું તાંત્રિક અને વૈજ્ઞાનિક ઢબે અમલીકરણ પ્રવૃત્તિઓ સુચારુ રીતે કરાવવા જંતુનાશક અધિકારીના વડપણ હેઠળ દરેક ઝોનના આસી.જંતુનાશક અધિકારી દ્વારા હાથ ધરાય તે જોવાની સીધી જવાબદારી વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગનાં વડાની રહેશે.
- ખાતાની કામગીરીમાં જોડાયેલ દરેક કર્મચારીના હોદ્દા મુજબ ફરજો અને જવાબદારીઓની સૌંપણી કરી નક્કી કરેલ કાર્યયોજના (Action Plan) મુજબ પ્રવૃત્તિઓ અને પેટા પ્રવૃત્તિઓની કામગીરી અને તેની સિદ્ધિઓ નક્કી કરેલ માપદંડ મુજબ અદા કરાવવાની રહેશે.
- શહેરી વિસ્તારોની રચનાને ધ્યાને રાખી મેલેરીયા, ફાઈલેરીયા, ડેન્યું, ચીકનગુનિયા જેવા રોગોનું સર્વેલન્સ અઠવાડિક/પખવાડિક ધોરણે હાથ ધરાવી રોગોનું ભારણ ઘટાડવા જુદા જુદા વાહકો જેવા કે, મચ્છર, માખી, રેટફલી, સેન્ડફલાઈને અસરકારક પગલાઓ લઈને અંકુશ હેઠળ રાખવાના રહેશે.
- વાહક જન્ય રોગોના અટકાવ અને નિયંત્રણ માટે ભારત સરકાર, રાજ્ય સરકાર તેમજ WHO દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ સ્પેશીઝીકેશન મુજબની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી અસરકારક જંતુનાશક દવાઓ અને લાર્વીસાઈડસ દવાઓ સમયસર ઉપલબ્ધ કરાવી અને પુરી પાડવાની રહેશે.
- વાહક જન્ય રોગોનાં સચોટ નિદાન અને સારવાર માટે જરૂરી અને જીવનરક્ષક દવાઓ તથા પ્રાયોગિક પરિક્ષણો માટે જરૂરી એવી તમામ સાધન સામગ્રી અને વિશિષ્ટ ઉપકરણો ઉપલબ્ધ કરાવવા અને પુરા પાડવાના રહેશે.
- શહેરની વસ્તી અને વાહક જન્ય રોગોનું ભારણ ધ્યાને રાખીને મુદ્દા નં. ૬ અને ૭ તથા વાહક જન્ય રોગોનાં અમલીકરણ માટે જરૂરી મેન પાવર તથા બજેટની જોગવાઈ અને નિયમોનુસાર ખર્ચ કરી નાશાકીય અને ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની રહેશે.
- વાહક જન્ય રોગોમાં ઉદ્ભવતા રોગચાળાઓ કે કેસોમાં અસાધારણ વધારો નિયંત્રિત કરવા રોગચાળો ઉગતો જ ડામી દેવાની પૂર્વ તૈયારીઓ અને તેનો વહેલાસરનો પ્રતિભાવ આપવા યુધ્ધના ધોરણે લેવાના થતા પગલાઓનું આયોજન કરાવવાનું રહેશે. આ અંગે વિવિધ ખાતાઓનું સંકલન, સામેલગીરી અને સહકાર ભ્યુનિસીપલ કમિશનરશ્રીના અધ્યક્ષપણા હેઠળ કેળવવાનો રહેશે.

9. જોનમાંથી જંતુનાશક દવાની ડિમાન્ડ મંગાવવી.
10. આ ડિમાન્ડના આધારે જંતુનાશક દવા ખરીદી કરવા અંગે ટેન્ડર તૈયાર કરવા તથા વર્તમાનપત્રોમાં નોટીસ આપવી.
11. જંતુનાશક દવાના ભાવ મંજૂર કરાવવા દરખાસ્ત બનાવવી.
12. જરૂરીયાત મુજબ ડે.કમિશનરશ્રી(સ્પે.)ની મંજૂરીથી ઓર્ડર આપી ખરીદી કરવી.
13. જંતુનાશક દવાના સેમ્પલ ટેસ્ટીંગ કરાવવા, જોનમાં દવાની ફાળવણી, પાર્ટીના પેમેન્ટ અંગેની કાર્યવાહી કરવી, સિક્યોરીટી ડિપોઝીટ રિલીઝ કરવાની કાર્યવાહી વિગેરે.
14. જંતુનાશક દવાઓના ખાલી ટીન બેરલ/બંગાર વિગેરે છેપ કરી ટેન્ડરથી વેચાણ કરાવવું.
15. અન્ય સાધન સામગ્રી જેવી કે હેન્ડ કોમ્પ્રેસર પંપ, બેટરી સેલ વિગેરે ખરીદવાની કાર્યવાહી કરવી.
16. ફોગીંગ મશીનો તથા માઈક્રોસ્કોપ સર્વિસ/રીપેરીંગ કરાવવાની કાર્યવાહી કરવી.
17. ઉપરી અધિકારી તરફથી સોપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

### આસી.જંતુનાશક અધિકારી :-

- (૧) આસી.જંતુનાશક અધિકારી તેમને આપવામાં આવેલ જોનમાં થતી કામગીરી માટે જવાબદાર છે.
- (૨) આસી.જંતુનાશક અધિકારીએ જે તે વિસ્તાર તેમજ રોજબરોજની કામગીરીથી માહિતગાર થવા ઉપરાંત તેમણે ઈન્સેક્ટીસાઇડ ઓફિસરની સુચનાઓનો પણ ત્વરીત અમલ કરવાનો રહેશે.
- (૩) તેમને આપવામાં આવેલ વિસ્તાર તેમજ પોતાની ફરજથી માહિતગાર થવું એ એમની પહેલી ફરજ છે, તેમજ તેમના વિસ્તારમાં રોજ બરોજની કામગીરી અને મેલેરીયા-ફાઈલેરીયા રોગની એપીડેમીયોલોજીસી તરત જ માહિતગાર થવાનું હોય છે.
- (૪) કામગીરી માટે કર્મચારીઓને બે જૂથમાં વહેચવામાં આવ્યા છે. (અ) વહીવટી (બ) ક્ષેત્રીય કામગીરી માટે, ફાઈલેરીયા/મેલેરીયા ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર, પ્રાયમરી હેલ્પ વર્કર, ફિલ્ડ વર્કર અને ડ્રાયવરનો સમાવેશ ક્ષેત્રીય સ્ટાફમાં થાય છે.તે તમામ સ્ટાફ નિષાપૂર્વક ફરજ બજાવે છે તે જોવાનું રહેશે.
- (૫) વિસ્તારમાં ઘરોની સંખ્યા, વિસ્તારમાં વસતા લોકોની સંખ્યા તેમજ પ્રકાર અને જે તે વિસ્તારમાં મળતા કાયમી અને બિનકાયમી બિંડીગના આધારે જે તે વિસ્તારમાં આસી.જંતુનાશક અધિકારી તેમને સોપવામાં આવેલ વિસ્તારમાં ફરજ પર મુક્કવામાં આવતા યુનિટની સંખ્યા, દરેક યુનિટ પર પ્રાયમરી હેલ્પ વર્કરની સંખ્યા અને ફિલ્ડ વર્કરની સંખ્યા રાષ્ટ્રીય નોર્મસને ધ્યાને રાખી નક્કી કરવાનું રહેશે.
- (૬) ટીમ લીડર તરીકે આસી.જંતુનાશક અધિકારી પોતાના વિસ્તારમાં કાર્યરત દરેક વર્કરને રૂબરૂ ઓળખતા હોવા જરૂરી છે, તેમજ તેમને સોંપેલ કામગીરી સારી રીતે પુરી પાડે એ માટે એમને સાચું માર્ગદર્શન પૂરુષ પાડી એમનો આત્મવિશ્વાસ વધારે એ જરૂરી છે.
- (૭) ફિલ્ડમાં કાર્યરત દરેક મેલેરીયા/ફાઈલેરીયા ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર, મેલેરીયા સર્વેલન્સ વર્કર, ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વેલન્સ વર્કર, પ્રાયમરી હેલ્પ વર્કર પાસે વર્કડાયરી રખાવવાની રહેશે, જેમાં દરરોજની કામગીરીની નોંધ રાખે છે કે કેમ તે જોવાની જવાબદારી રહેશે તેમ જ જયારે તેમના ઉપરી અધિકારી જોવા માંગે ત્યારે એમને બતાવવાની રહેશે.
- (૮) આસી.જંતુનાશક અધિકારીએ તેમના વિસ્તારની દરરોજની કામગીરી, અઠવાડિક કામગીરી અને મંથલી કામગીરીના રીપોર્ટ અંગેના શિડ્યુલ બનાવીને સમય મર્યાદામાં તૈયાર કરાવી તેમના કાયમી રેકૉર્ડ સાચવવાના રહેશે.
- (૯) આસી.જંતુનાશક અધિકારીએ પોતાના વિસ્તારમાં થતી કામગીરી અંગેની માહિતી ઈન્સેક્ટીસાઇડ ઓફિસર(વાહક જન્ય રોગ)ને પુરી પાડીને સમગ્ર શહેરની કામગીરી કરવામાં મદદરૂપ થવાનું રહેશે.
- (૧૦) એન્ટીલાર્વલ કામગીરી કરનારા, ફાઈલેરીયા મેલેરીયા ઈન્સપેક્ટરોએ, આસી.જંતુનાશક અધિકારીની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરવાની રહેશે.

- (૧૧) યુનિટ લેવલે થતી વાહક જન્ય રોગોને નિયંત્રણ કરવાની તમામ કામગીરીથી વાકેફ થવાનું રહેશે. તેમણે સમયાંતરે સુચિત માપદંડોને આધારે વર્કર વાઈજ અને વિસ્તારવાઈજ મોનીટરીંગ અને મુલ્યાંકન કરવાનું રહેશે.
- (૧૨) મેલેરીયા, ડેન્યુ, ચિકુનગુનિયાના પોઝીટીવ કેસના વિસ્તારમાં તેમજ તેમની આસપાસના વિસ્તારમાં ઈન્ડોર સ્પેસ સ્પ્રે અથવા પ્રાયરેશ્રોઈડ ફોણીગની કામગીરી કરાવવી.
- (૧૩) કેમીકલ કંટ્રોલના વધુ ઉપયોગને બદલે એમણે જ્યાં શક્ય હોય ત્યાં બાયો એન્વાપરમેન્ટલ કંટ્રોલ મેજર્સનો વધુ ઉપયોગ કરવાનો રહેશે. લાર્વા ભક્ષક માછલીઓ જેવી કે, ગંભૂરીયા અને ગાપીની હેચરીઝ (Hatcheries) બનાવડાવવાની રહેશે.
- (૧૪) આસી.જંતુનાશક અધિકારીએ જે તે વિસ્તારના મચ્છરની દર છ મહિનાના અંતરે WHO લાર્વલ સસેપ્ટીબીલીટી ટેસ્ટ દ્વારા જે તે રોગના વાહક મચ્છરનું સસેપ્ટીબીલીટી સ્ટેટ્સ જંતુનાશક અધિકારીને જણાવવાનું રહેશે. આસી.જંતુનાશક અધિકારીએ ઈન્સેક્ટીસાઈડ ઓફિસરને કામગીરીના મંથળી ટેક્નીકલ રીપોર્ટ તેમજ એન્યુઅલ રીપોર્ટ આપવાના રહેશે.
- (૧૫) ડોમેસ્ટિક તેમજ પેરીડોમેસ્ટિક કંટ્રોલ માટે કાયદાકીય નિયમો કરક રીતે લોકો દ્વારા પાડવામાં આવે એની તક્કેદારી આસી.જંતુનાશક અધિકારીએ રાખવાની રહેશે.
- (૧૬) આસી.જંતુનાશક અધિકારીએ જે તે વિસ્તારમાં પ્રાયવેટ પ્રેક્ટીશનર, હોસ્પિટલ, કિલનીક તેમજ ડીસ્પેન્સરીના ડોક્ટર સાથે સંકલન કરી પેસીવ સર્વેલન્સની કામગીરી સઘન બનાવવાની રહેશે.

### મેડીકલ ઓફિસર :-

- (૧) મેડીકલ ઓફિસર સમગ્ર કામગીરીના માળખામાં Early case detection અને Complete treatment માટે અગત્યની ચાવી છે. મેડીકલ ઓફિસર આ અંગેની કામગીરી અર્થે સારી રીતે ટ્રેઈન થયેલા હોવા જોઈએ, તેમજ તેમનો સદર કામગીરીમાં સંપૂર્ણ રસ હોવો જરૂરી છે.
- (૨) તેમણે આસી.જંતુનાશક અધિકારી સાથે મળી જે તે વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ વિઝીટ માટે પ્રાયમરી હેલ્પ વર્કરનો પખવાડિક શિરડુલ તેયાર કરવાનો રહે છે.
- (૩) તેમણે દવા આપતા પહેલા તાવના દરેક કેસનો લોહીનો નમૂનો મેલેરીયા ટેસ્ટ માટે લેબોરેટરી માં મોકલવાનો રહેશે.
- (૪) તેમણે પોતાના વિસ્તારમાં આવેલ મેલેરીયા કલીનીક તેમજ હેલ્પ સેન્ટર પર લેવાનારા લોહીના નમૂનાની ગુણવત્તા, તેનું સ્ટેઇનીગ તેમજ માઈક્રોસ્કોપીક એક્ઝામીનેશન બરાબર છે કે નહિ તેમજ લોહીના નમૂના દરરોજ સ્ટેઇન કરવામાં આવે છે કે નહિ એ ચેક કરવાનું રહેશે.
- (૫) તેમના વિસ્તારમાં આવેલ હેલ્પ સેન્ટર ઉપર ફરજ બજાવતા લેબોરેટરી ટેક્નીશીયન K-7, 8 અને 9 રજીસ્ટર મેર્ધન્ટેઇન કરે છે ? તેમજ સબ સેન્ટરવાઈજ અને પેસીવ એજન્સીવાઈજ બ્લડ સ્મીયર કલેક્શન એક્ઝામીનેશન અને પોઝીટીવ કેસોના આંકડા દર્શાવતા ચાર્ટ તેમજ ગ્રાફ વ્યવસ્થિત રીતે ડીસ્પ્લે કર્યા છે કે નહિ એ જોવાની જવાબદારી મેડીકલ ઓફિસરની છે.
- (૬) પોઝીટીવ કેસને ૨૪ કલાકમાં રેડીકલ ટ્રીટમેન્ટ મળે એની તક્કેદારી રાખવાની રહેશે.
- (૭) મેલેરીયા કેસોને સારવાર અર્થે જરૂરી દવાઓનો જથ્થો પુરતો છે કે નહિ એ અંગેની તક્કેદારી મેડીકલ ઓફિસરે રાખવાની રહે છે.
- (૮) તેમણે પોતાના વિસ્તારમાં કાર્યરત મેલેરીયા કલીનીક અથવા અર્બન હેલ્પ સેન્ટરની મુલાકાત દરમ્યાન લેબોરેટરીમાં વપરાતા સાધનો જેવા કે, માઈક્રોસ્કોપ, ગ્લાસ સ્લાઈડ, સ્ટેઇન વગેરેની ચકાસણી કરવાની રહેશે.
- (૯) તેમણે ફિલ વિઝીટ દરમ્યાન ચકાસણી કરવાની રહેશે કે પ્રાયમરી હેલ્પ વર્કર મેલેરીયા કેસ ડિટેક્શન એમને જણાવ્યા મુજબની ગાઈડલાઈન અનુસાર કરે છે કે કેમ ?

- (૧૦) એપીડેમીયોલોજીકલ ઈન્વેસ્ટીગેશન માટે તેમણે જે તે વિસ્તારમાં થતી કામગીરીના ડેટાનું એનાલીસીસ કરી લેવાના અટકાયત પગલાં તેમજ રોગની આઉટબ્રેક થવાની પરિસ્થિતિ છે કે કેમ એ અંગેનું મોનીટરીંગ કરવાનું હોય છે.
- (૧૧) તેમણે પોતાના વિસ્તારમાં રૂગ ફેલિયર કેસનું મોનીટરીંગ કરી ઈન્સેક્ટીસાઇડ ઓફિસર (H.Q.)ને જાણ કરવી.
- (૧૨) મેલેરીયાના જટિલ અને સિવીયર કેસ કે જેની સારવાર હેલ્થ સેન્ટર ઉપર શક્ય ન હોય એવા કેસને મસ્કતિ, સ્મીચેર અથવા નવી સિવીલ હોસ્પિટલ જેવી સેન્ટીનલ હોસ્પિટલ ઉપર રીફર કરવા.
- (૧૩) મેલેરીયા પોઝીટીવ કેસોના રેકોર્ડ બરાબર મેઈન્ટેઇન થાય છે કે નહિ એની તકેદારી રાખવી.

### સેક્શન ઓફિસર અને જાહેર માહિતી અધિકારી :-

- વહીવટને લગતી તમામ કામગીરી કરાવવી.
- ઈ.ચા.જંતુનાશક અધિકારી ધ્વારા મળતા સૂચનો/કામગીરીનો અમલ કરાવવો.
- જંતુનાશક દવાના ભાવ મંજૂર કરાવવા અંગેની દરખાસ્ત તૈયાર કરવી.
- મહેકમ/હાજરીપત્રકને લગતી કામગીરી કરાવવી.
- ઉપરી અધિકારી તરફથી સોપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.
- બીજી શ્રેણી સુધીના કલેરીકલ કેડરના પગાર અગેના ઈજાર મંજૂર કરવા તેમજ બજેટમાં કરેલ જોગવાઈ મુજબ રજા, પ્રવાસ અંગેનો બીલો મંજૂર કરવા

### દેઢ કલાર્ડ (પથમ શ્રેણી કલાર્ડ )

- કચેરીનું હાજરીપત્રક જાળવણી કરી હાજરીપત્રકમાં હાજરીનું ચેક્ઝિગ કરી કર્મચારીઓના રજા બાબતના શેરા હાજરીપત્રકમાં કરવા.
- પ્રોસીક્યુશન અને કોર્ટ કેસ અંગેની કામગીરી સંભાળવી.
- રાઈટ ટુ ઈન્ફોર્મેશન અંગેની કામગીરી સંભાળવી.
- ગુજરાત રાજ્ય સરકાર તરફથી અગાર અન્ય સંસ્થાઓ તરફથી આવતા પત્રવ્યવહાર અંગેની કામગીરી કરવી.
- ડેડ સ્ટોક ૨જીસ્ટર મેઈન્ટેઇન કરવું
- ઓડિટ ઓફ્ઝિક્શનનો નિકાલ કરાવવાની કામગીરી સંભાળવી.
- ઓફિસ ખરીદી અંગેના ડેડ સ્ટોક ૨જીસ્ટરની જાળવણી કરવી.

### લેબોરેટરી ટેકનીશીયન :-

- જોનમાંથી આવેલ મેલેરીયા/ફાઈલેરીયા સ્લાઈડોનું સ્ટેનીંગ કરી પરિક્ષણ કરવું તથા સમયસર પરિણામ આપવું.
- શંકાસ્પદ ડેન્યુ/ચિકુનગુનિયા કેસોના સેમ્પલ લઈ પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવા.
- મેલેરીયા/ફાઈલેરીયાની સ્લાઈડનું પરિક્ષણ તથા તેને સંલગ્ન એન્ટોમોલોજીકલ વર્ક કરવું.
- સમગ્ર શહેરમાંથી એકત્રીત કરેલ સ્લાઈડોનો ડેવાઈઝ, વીકવાઈઝ, મન્થવાઈઝ, કોડવાઈઝ, ઈયરવાઈઝ, યુનિટવાઈઝ, ઝોનવાઈઝ ડેટા મેઈન્ટેઇન કરવા તથા ઉપરી અધિકારી માંગે ત્યારે જે-તે મુજબની સચોટ માહિતી પૂરી પાડવી.
- મેલેરીયા માટે પોઝીટીવ જાહેર થયેલ દર્દીને "મેલેરીયા પત્રક" જરૂરી વિગત ભરીને અચુક આપવું. જેથી ફરીવાર દર્દી સારવાર માટે શહેરી આરોગ્ય કેન્દ્ર/લેબોરેટરી ટેકનીશીયન પાસે આવે ત્યારે આ કાર્ડ સાથે લાવે તેવો આગ્રહ રાખવા માટે જણાવવું.

- ઇન્સેક્ટ કલેક્ટર દ્વારા કલેક્ટ થયેલ મચ્છરોનું આઈન્ટીફીકેશન તથા ફાઈલેરીયા માટે ડિસેક્ટ કરેલ મચ્છરોની સ્લાઇડનું પરીક્ષણ કરી રોજે રોજની મેલેરિયા, ફાઈલેરીયા અને એડિસ વેક્ટર ડેન્સીટીની માહિતી તૈયાર કરવાની તથા મેલેરિયા અને એડિસ વેક્ટર મળેલ સ્થળની જાણ જંતુનાશક અધિકારી તથા જે તે ઝોનના આસી. જંતુનાશક અધિકારીને કરવાની રહેશે. ઉપરોક્ત તમામ માહિતી ડેવાઈઝ, મન્થવાઈઝ, ઈયરવાઈઝ, યુનિટવાઈઝ તેમ જ ઝોનવાઈઝ તૈયાર કરવાની રહેશે.
- ઉપરી અધિકારી તરફથી સૌંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

### કલાક :-

- કલેરીકલને લગતી તમામ કામગીરી કરવી.
- દરેક ઝોનમાંથી જંતુનાશક દવાની ડિમાન્ડ મંગાવી રજુ કરવી, ટેન્ડર બનાવવા.
- જંતુનાશક દવાના બીલ બનાવી પેમેન્ટની કાર્યવાહી કરવી.
- એચીમેન્ટ તૈયાર કરાવવા.
- કોમ્પ્યુટર પર પ્રોગ્રામ એન્ટ્રી કરી જુદા જુદા પત્રકો તૈયાર કરવા.
- કોમ્પ્યુટર પર ખાતાને લગતી તમામ કામગીરી/રેકર્ડ્સ તૈયાર કરવા.
- ઉપરી અધિકારી તરફથી સૌંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

### સ્ટોર કીપર :-

- જંતુનાશક દવાનો બીલ મુજબનો સ્ટોક મેળવી તેની ચકાસણી કરી, જુદા જુદા ઝોનોમાં જરૂરીયાત મુજબ વિતરણ કરવું.
- જંતુનાશક દવાના સેમ્પલો ટેસ્ટીંગ માટે મોકલવા.
- કોમ્પ્યુટર પર સ્ટોર રિસીવર વાઉચર (SRV) અને સ્ટોર ઈસ્યુ વાઉચર (SIV) તૈયાર કરવા.
- ઉપરી અધિકારી તરફથી સૌંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

### સેનેટરી ઇન્સપેક્ટર (વી.બી.ડી.સી) :-

- (૧) તે વાહક જન્ય રોગ નિયંત્રણ અંગેની તમામ કામગીરી બાબતનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. એન્ટીલાર્વલની કામગીરી, પાયરેથ્રમ દ્વારા થતી ધૂમ્રસેરની કામગીરી અને મચ્છર ઉત્પત્તિ સ્થાનો ઘટાડવા અંગેના વિવિધ પગલાઓ જેવા કે, બાયો-એન્વાયરન્મેન્ટલ નિયંત્રણના પગલાઓ બાબતે સુમાહિતગાર હોવો જોઈએ. પોરાભક્ષક માછલીઓ દ્વારા પોરાનાશક કામગીરીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. રાસાયણિક પોરાનાશક દવાઓના ઉપયોગ બાબતે જાણકાર હોવો જોઈએ.
- (૨) તેના તાબા હેઠળના કર્મચારીઓની રોજે રોજની કામગીરી બાબતે તે પોતે સંપુર્ણ જવાબદાર રહેશે. જંતુનાશક દવા વપરાશ તેમજ પોરાનાશક તેલના વપરાશની રોજે રોજની નોંધ તેણે સ્ટોક રજીસ્ટરમાં કરાવવાની રહેશે.
- (૩) તેણે ટોર્ચ, ડીપ, દોરી, વર્ક ડાયરી હંમેશા પોતાની સાથે રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી તેને નિયત ડોઝમાં યોગ્ય જંતુનાશક દવાનો ઇંટકાવ કરાવવાનો રહેશે.
- (૪) કર્મચારીઓ દ્વારા યોગ્ય સ્થાને યોગ્ય માત્રામાં દવા ઇંટકાવની કામગીરી કરવામાં આવે, દવાનો દુરૂપયોગ ન થાય, તેમજ જરૂરીયાત મુજબ દવાનો આગોતરો જથ્થો સંગ્રહ કરવા અંગેની જવાબદારી તેમની રહેશે.
- (૫) તેણે વિસ્તારમાં ટ્રીટમેન્ટ આપ્યા વિનાના મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢી તાત્કાલિક તે અંગેની જાણ આસી. જંતુનાશક અધિકારીશ્રી અને જંતુનાશક અધિકારીશ્રીને કરવી.

- (૬) તેણે મચ્છર નિયંત્રણ પ્રોગ્રામનું સઘન અને નિષ્ઠાપુર્વકનું કોસ ચેકીંગ હાથ ધરવાનું રહેશે.
- (૭) તેના તાબા હેઠળના કર્મચારીઓ ફરજના પુરેપુરા સમય દરમ્યાન ફિલ્ડમાં કાર્યરત રહે તે અંગેની તકેદારી રાખવી. તેના વિસ્તારમાં ટ્રીટમેન્ટ આધ્યા વિનાના મળેલ બિડીંગ માટે તેઓ પોતે જવાબદાર ગણાશે. તેણે જાતે લાર્વલ ડેન્સીટી/એડલ્ટ ડેન્સીટીનું વ્યક્તિગત કોસ ચેકીંગ કરવાનું રહેશે.
- (૮) તેણે એક્ટીવ-પેસીવ સર્વેલન્સ, ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વે, પેરી ડોમેસ્ટીક સર્વેની તમામ કામગીરીનું સુપરવિઝન કરવાનું રહેશે.
- (૯) એમના યુનિટમાં ફાળવવામાં આવેલ જંતુનાશક દવાઓ, સાધન-સામગ્રીનો દુરુપયોગ કે ઉચાપત ન થાય તેની તકેદારી લેવી. અન્યથા તેની તમામ જવાબદારી એમના શીરે રહેશે.
- (૧૦) તેણે સાધન-સામગ્રીના યોગ્ય નિભાવની તકેદારી રાખવી અને ગુમ થયેલ સાધન-સામગ્રી બાબતે જવાબદારી નક્કી કરી ઉપરી અધિકારીને ધ્યાને વિગત લાવવાની રહેશે.
- (૧૧) તેણે તમામ પ્રકારના મચ્છરોની ઓળખ કરતા આવડવું જોઈએ. વિશેષ કરીને એનો ફીલીસ સ્ટેફન્સી અને એનોઝીલીસ ક્યુલીસીફેરીસથી માહિતગાર હોવા જોઈએ.
- (૧૨) તેણે સ્ટોક રજીસ્ટર, લોગબુક, ફૈનિક રીપોર્ટ વગેરેનું રીપોર્ટિંગ કરી રિપોર્ટ આસી. જંતુનાશક અધિકારી/જંતુનાશક અધિકારીશ્રીને સમયમર્યાદામાં નિયમિત પહોંચાડવાનો રહેશે.
- (૧૩) તેણે તેનો ફિલ ચેકીંગનો પ્રોગ્રામ એવી રીતે બનાવવો કે જેથી ફિલના તમામ ઉત્પત્તિ સ્થાનો મહિનામાં ઓછામાં ઓછા એક વાર ચેક કરી શકાય.
- (૧૪) મચ્છર વધુ હોય તેવા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનો કયાસ તેણે સમયાંતરે નિયમિત રીતે હાથ ધરવો. તેના વિસ્તારના નવા ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢી આસી. જંતુનાશક અધિકારીશ્રી /જંતુનાશક અધિકારીશ્રીના ધ્યાન ઉપર લાવી રેકર્ડમાં નોંધ કરી જરૂરી પગલાં લેવા.
- (૧૫) તાબા હેઠળના કર્મચારીઓના વિસ્તારમાં સવારે અને સાંજે એમ બને સમયે કર્મચારીઓની હાજરી લેવી.
- (૧૬) નોટીસ ઈસ્યુ કરવા છતાં સમય મર્યાદામાં ખામી દૂર ન કરનાર ઈસમો પાસેથી વહીવટી ખર્ચ વસુલાતની અથવા કોર્ટ કેસની કામગીરી કરવાની રહેશે.
- (૧૭) યુનિટની તમામ કામગીરીનું સંપૂર્ણ સુપરવીઝન તેમણે કરવાનું રહેશે.
- (૧૮) તેણે તેમના ઉપરી અધિકારીઓ દ્વારા જે સુચના મળે તે મુજબની કામગીરી કરવાની રહેશે.

### સેનેટરી સાબ ઈન્સપેક્ટર (વી.બી.ડી.સી) :-

- (૧) તેઓને ફાળવવામાં આવેલ એન્ટીલાર્વલ વર્કની રોજેરોજની કામગીરી, સર્વેલન્સ અને ઈન્ટ્રાડોમેસ્ટીક વર્કની કામગીરી અને સ્ટાઇનું સુપરવીઝન કરવાનું રહેશે.
- (૨) તેઓએ તેમના વોર્ડ-વિસ્તારમાં રોજે રોજ ઉપયોગમાં લેવામાં આવતી જંતુનાશક દવાના વપરાશની માહિતી રાખવાની રહેશે. જે માહિતીની નોંધ ફાઈલેરીયા મેલેરીયા ઈન્સપેક્ટરને લખાવવી.
- (૩) તેણે ટોર્ચ, ડીપ, દોરી, વર્ક ડાયરી હંમેશા પોતાની સાથે રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી તેમાં નિયત ડોઝમાં યોગ્ય જંતુનાશક દવાનો છાંટકાવ કરાવવાનો રહેશે.
- (૪) તેણે તેના તાબા હેઠળના પ્રાઈમરી હેલ્પ વર્કર તેમજ બેલદારને ફરજના પુરેપુરા સમય સુધી ફિલમાં હાજર રહી તમામ બિડીંગ સ્થાનો પર માઈનોર એન્જી. વર્ક કરી દવાનો છાંટકાવ કરે તેની તકેદારી રાખવાની રહેશે. જો કોઈ પણ ઉત્પત્તિ સ્થાન ટ્રીટમેન્ટ આધ્યા વગરનો જણાશે તો તે માટે તેની જવાબદારી ગણવામાં આવશે.
- (૫) સાધન-સામગ્રી સારી (ચાલુ) હાલતમાં રહે, અને રોજે રોજ તેની કાળજી લેવાય તે મુજબ વ્યવસ્થા કરવી.
- (૬) તેણે તેના તાબા હેઠળના કર્મચારીઓના ઉપ-વિસ્તારો અને બિડીંગ સ્થાનો દર્શાવતો નકશો રાખવાનો રહેશે અને તેની નકલ તાબા હેઠળના પ્રાયમરી હેલ્પ વર્કરને આપવી, અને જરૂરી માર્ગદર્શન પુરું પાડવું.
- (૭) કચરા રહીત અને લીલ રહીત ગટરો રહે તે જોવું કે જેથી છાંટવામાં આવેલ જંતુનાક દવાનું પરિણામ મળે તેની તકેદારી રખાવવી.
- (૮) તેના સમગ્ર કાર્યક્ષેત્ર વિસ્તારને ઈ પેટા વિભાગોમાં વહેંચી તેની જે તે દિવસની સીમા રેખા દર્શાવતો નકશો તૈયાર કરવો.

- (૯) તેના તાબા હેઠળનાં કર્મચારીઓની શિસ્ત અંગેની જવાબદારી તેના શીરે રહેશે, ફિલ્ડમાં કર્મચારીઓની સવારની અને સાંજની હાજરી તેણે રૂબરૂમાં લેવી.
- (૧૦) તાબા હેઠળના કર્મચારીઓને સવારે સાધન-સામગ્રી આપવી અને સાંજે બરાબર સફાઈ કરાવડાવી પરત મેળવવી.
- (૧૧) તમારા યુનિટમાં ફાળવવામાં આવેલ જંતુનાશક દવાઓ, સાધન-સામગ્રીનો દુરૂપયોગ કે ઉચાપત ન થાય તેની તકેદારી લેવી. અન્યથા તેની તમામ જવાબદારી તમારા શીરે રહેશે.
- (૧૨) ગુમ થયેલ સાધન-સામગ્રી અંગે સબંધિત કર્મચારીની જવાબદારી નક્કી કરી તાકીદે તેનો રીપોર્ટ ફાઈલેરીયા-મેલેરીયા ઈન્સપેક્ટરને તાત્કાલિક રીકવરી માટેની કાર્યવાહી માટે કરવો. તેમજ આવા ગુમ થયેલ સાધન-સામગ્રીના ગુમ થવા અંગેના કારણો શોધી વિગતવાર વાસ્તવિક કારણો સહીતનો લેખિત રીપોર્ટ ઉપરી અધિકારીને કરવો.
- (૧૩) અર્બન હેલ્થ સેન્ટરનો પોઝિટીવ કેસોની માહિતી મેળવી કરવા જોગ કામગીરી જેવી કે, એન્ટીમેલેરીયલકામગીરી, ધુમસેર, માસ અને કોન્ટેક્ટ સ્મીયર, ફોલોઅપ સ્મીયર, ફોલોઅપ ટ્રીટમેન્ટ કામગીરી કરવી.
- (૧૪) માસ ટ્રીટમેન્ટની કામગીરી અને તેનો રેકર્ડ તેના ઉપરી અધિકારીને મોકલવાની જવાબદારી તેમની રહેશે.
- (૧૫) તેના કાર્યક્ષેત્ર વિસ્તારમાં રેડીકલ ટ્રીટમેન્ટ રૂબરૂ આપવાની જવાબદારી તેના શીરે રહેશે.
- (૧૬) નોટીસ ઈસ્યુ કરવા છીતાં સમય મર્યાદામાં ખામી દૂર ન કરનાર ઈસમો પાસેથી વહીવટી ખર્ચ વસુલાત કરવાનો રહેશે. તથા કોર્ટ કેસની કામગીરી આપવામાં આવેલ ટાર્ગેટ મુજબ તેણે કરવાની રહેશે.
- (૧૭) તેણે તેમના ઉપરી અધિકારીઓ દ્વારા જે સુચનો મળે તે મુજબની કામગીરી કરવાની રહેશે.
- (૧૮) તેણે પોતાના વિસ્તાર માટે મેળવેલ જંતુનાશક દવા અને મેલેરીયા વિરોધી ઔષ્ઠધાનો જથ્થો મેળવ્યાની નોંધણી સ્ટોક રજીસ્ટરમાં કરવાની રહેશે.

### પાયમરી હેલ્થ વર્કર (ઇન્સેક્ટ કલેક્ટર) ની ફરજો:-

આઈ.સી. મચ્છર નિયંત્રણ ઓપરેશનના કોસ ચેકીંગ કાર્યનો એક ભાગ છે. તે નિયંત્રણ કાર્યના નિરીક્ષણ અને કાર્યમાં અને કામગીરીમાં સુધારામાટે ચાવીરૂપ ભૂમિકા નિભાવી શકે છે. તેણે કલેક્શન માટેની જરૂરી સાધન સામગ્રી રાખવાની રહેશે. તેણે એન્ટોમોલોજીકલ ડેટા ખૂબ જ ઈમાનદારીપૂર્વક આપવાના હોય છે. તેના દ્વારા પુરેપુરી ઈમાનદારીથી નહીં આપવામાં આવેલ ડેટા નિયંત્રણ પ્રોગ્રામની કામગીરીને ગેર માર્ગ દોરનારા અને અર્થ-હીન સાબિત થાય છે. તેણે પોતાની જાતને મચ્છર પકડવાની પદ્ધતિ સાથે સુસંગત કરવાની રહે છે. તે ઈચ્છનીય છે કે તે આ કામગીરી માટે કેળવાયેલ હોય અને તે જાણતો હોવો જોઈએ કે તેણે શું કરવાનું છે? અને કેવી રીતે કરવાનું છે? તેણે તેની કામગીરીની જરૂરિયાત માટેની સાધન સામગ્રી ફરજના સમય દરમ્યાન અચુક પણે સાથે રાખવાની રહેશે. જે નીચે મુજબ છે.

- (૧) કેનવાસની બેગ
- (૨) એક મોસ્કીટો સક્ષણ ટયુબ
- (૩) ટેસ્ટ ટયુબસ
- (૪) કોટન

- (૧) જે તે દિવસે તેને ફાળવેલ કલેક્શન સેન્ટરો પૈકી તેણે દરેક સેન્ટરો પર ૧૫ મીનીટ ફિક્સ કલેક્શન સેન્ટર ઉપરાંત ૧૫ મીનીટ રેન્ડમ કલેક્શન સેન્ટર ઉપર કામગીરી કરવી.
- (૨) પ્રતિદિન તેણે પાંચ ફિક્સ (રૂટિન) અને પાંચ રેન્ડમ કલેક્શન સેન્ટરોની મુલાકાત લેવાની રહેશે. આમ અઠવાડીયા દરમ્યાન તેણે ૨૫ ફિક્સ તેમજ ૨૫ રેન્ડમ મચ્છર પકડવાના સ્થળોની મુલાકાત લેવાની રહે છે. તેણે તેના આગમનની સુચના ઘરના કબજેદારને આપવી અને તે સેન્ટર પર કલેક્શનના સમય દરમ્યાન

કોઈ પુરુષ ફેમીલી મેમ્બર ઘરના અંદરનાં રોકાણ દરમ્યાન તેની સાથે રહે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.

- (૩) દરેક સેન્ટર પર કામગીરી ચાલુ કરતા પહેલા પોતાના કામગીરી રજીસ્ટરમાં સમયની નોંધ કરવી. ત્યાર બાદ તરત જ કામગીરી શરૂ કરવી. કલેક્શન સેન્ટરમાં ઘરના એક નાકેથી તેણે મચ્છરની શોધ કરવી અને મચ્છરના આરામ કરવાના સ્થળો જેવા કે, અંધારા ખૂણા, ફર્નીચરના નીચેના સ્થાનો, દિવાલો પરના સાધનોની પાછળના સ્થળો ઉપરથી ટયુબમાં મચ્છરો પકડ્યા બાદ તેમને ટેસ્ટ ટયુબમાં ટ્રાન્સફર કરવા, અને ટેસ્ટ ટયુબના મુખને રૂથી બંધ કરવું. તુને એટલા નીચેથી બંધ કરવું કે, આ રીતે જ કલેક્શન એક જ ટેસ્ટ ટયુબમાં રાખી શકાય.
- (૪) ટેસ્ટ ટયુબના મુખને રૂ દ્વારા એવી રીતે બંધ કરવું કે જેથી મચ્છરો બહાર ઉડી શકે નહિ. આ મુજબના મચ્છરોને ટેસ્ટ ટયુબમાં મુક્યા બાદ તેણે કલેક્શન સેન્ટરના સ્થળ, મચ્છરના પ્રકાર વગેરેની માહિતી અને વિસ્તારનું નામ નોંધવાનું રહેશે.
- (૫) I.C. એ અલગ અલગ કલેક્શન સેન્ટરો પરથી પકડાયેલ મચ્છરો માટે અલગ અલગ ટેસ્ટ ટયુબ વાપરવાની રહેશે. મચ્છર મુકેલ ટેસ્ટ ટયુબને ભીના રૂનાં કપડામાં કે ઠંડી જગ્યામાં રાખવી અને મચ્છરની ઓળખ જે તે દિવસે જ કરી તેની વિસ્તૃત નોંધ રાખવી. તેણે એન્ટોમોલોજીકલ પદ્ધતિથી પ્રતિ વ્યક્તિ મચ્છરની ઘનતા (ઢિન્સીટી), પોરાની ઘનતા (લાર્વલ ડેન્સીટી) અને સસેપ્ટીબીલીટી ટેસ્ટ તમેજ પુખ મચ્છરોની ઓળખ વિગેરેની માહિતીની જાણકારી મેળવવાની રહેશે,
- (૬) તેમજ મચ્છરોની અને સાધનોની જાણવણી અને આંકડાકીય માહિતીની નોંધ અંગેની કામગીરી કરવાની રહેશે. તેણે ફિલ્ડ વિઝિટ દરમ્યાનાનેની લાર્વલની કામગીરીના સ્થળે સંલગ્ન વેક્ટર ડેન્સીટી અને લાર્વલ ડેન્સીટીની સરખામણી કરવાની રહેશે.
- (૭) જો કાયમી ફીક્સ સેન્ટર બંધ મળે તો તેણે તેના બદલે તે જ વિસ્તારનો એક રેન્ડમ સેન્ટર ઉપર વધારે કલેક્શન કરવું, પરંતુ જો કોઈ સેન્ટર કાયમી ધોરણે બંધ મળે તો સક્ષમ સત્તાની મંજૂરી મેળવી નવું સેન્ટર શરૂ કરવું.
- (૮) I.C. એ મચ્છરોની ઓળખ કરી તેનો રીપોર્ટ ઇન્સેક્ટિસાઇડ ઓફિસરને કરવાનો રહેશે.
- (૯) I.C. એ વિવિધ એન્ટોમોલોજીક ટેકનીક જેવી કે, મોસ્કીટો આઈડેન્ટીફીકેશન, મોસ્કીટો ડીસેક્શન, પર મેન અવર ડેન્સીટી, લાર્વલ ડેન્સીટી, સસેપ્ટીબીલીટી ટેસ્ટ વગેરેથી માહિતગાર થવાનું રહેશે.
- (૧૦) I.C. એ ફિલ્ડની મુલાકાત દરમ્યાન તેણે જુદા જુદા વિસ્તારોમાં એડલ્ટ વેક્ટર ડેન્સીટી તેમજ લાર્વલ ડેન્સીટીને ઘાને લઈ એન્ટીલાર્વલ કામગીરી સવારે ૫-૦૦ વાગ્યાથી બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધી કરવાની રહેશે.
- (૧૧) I.C. એ લેબોરેટરીમાં ફીમેલ મોસ્કીટો ડિસેક્શન અને ઇન્ફેક્ટિવીટી વગેરે શોધવાના અને નોંધવાનાં રહેશે. દર મહિનાને અંતે આખા માસ દરમ્યાન કરેલ ઇન્ટ્રાડોમેસ્ટીક કામગીરી બ્રિડીંગ રીપોર્ટ દ્વારા દર્શાવવાની રહેશે. જે દર મહિનાની પાંચ તારીખમાં જે તે મુખ્ય કચેરીની ફાઈલેરીયા લેબ.માં પહોંચાડવાની રહેશે.
- (૧૨) I.C. એ ટોર્ચ, ડીપ, દોરી, રજીસ્ટર હંમેશા પોતાની સાથે રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી મળેલ બ્રિડીંગનો નાશ કરાવવાનો રહેશે.

- (૧૩) I.C. એ તેના સેન્ટરો પરથી મળેલ વેક્ટરની જાણ જે તે યુનિટનાં એસ.આઈ., એસ.એસ.આઈ. અથવા હાજર રહેલ જવાબદાર કર્મચારીને જે તે દિવસે કરવાની રહેશે. આ ઉપરાંત તેમના ઉપરી અધિકારી દ્વારા જે સુચના મળે તે મુજબની કામગીરી કરવાની રહેશે.

### પ્રાયમરી હેલ્થ વર્કર (મેલેરીયા સર્વેલન્સ અને ઈન્ટ્રાડોમેસ્ટીક સવે.)ની ફરજો :-

મેલેરીયા કંટ્રોલ પ્રોગ્રામ વધુ ઘનિષ્ઠ અને પરિણામલક્ષી બનાવવા અંદાજીત દસ હજારથી અગિયાર હજારની વસ્તી/સૌંપવામાં આવેલ વિસ્તારને આવરી લેતાં અંદાજીત બે અજાર ઘરો/સૌંપવામાં આવેલ ઘરો પૈકી દરરોજ ૧૫૦ થી ૧૭૫ ઘરોમાં વાહકજન્ય રોગોને નિયંત્રણ હેઠળ રાખવા માટે સમગ્ર વિસ્તારનો પખવાડીક સર્વે કરવાનો રહેશે. જેમાં એક્ટિવ સર્વેલન્સ, ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વે, નોટીસ આપવી, કેસોનું ફોલોઅપ, ડ્રગ કોમ્પલાયન્સ જેવી તમામ કામગીરી કરવાની રહેશે. ઉપરાંત વેક્ટર બોર્ન ડીસીજ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળની અન્ય કામગીરી કરવાની રહેશે.

- (૧) પ્રાયમરી હેલ્થ વર્કરે તેને સોંપાયેલ વિસ્તારની વસ્તીનું રજીસ્ટર તેની યુનિટ ઓફિસે રાખવાનું રહેશે.
- (૨) પ્રાયમરી હેલ્થ વર્કરે તેના વિસ્તારમાં આવેલ ઘરોની દર પંદર દિવસે મુલાકાત લઈ ફીવર સર્વે/ઇન્ટ્રાડોમેસ્ટીક બ્રિડીગ સર્વે કરવો.
- (૩) પ્રાયમરી હેલ્થ વર્કરે ટોર્ચ, ડીપ, દોરી, રજીસ્ટર હંમેશા પોતાની સાથે ખાતા દ્વારા આપેલ હેન્ડબેગમાં રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી મળેલ બ્રિડીગનો ટેમીફોસ દ્વારા નાશ કરાવવાનો રહેશે.
- (૪) પ્રાયમરી હેલ્થ વર્કરે તેની ઘર-ઘરની મુલાકાત વેળા દરેક તાવના કેસનાં દર્દીની લોહીની સ્લાઈડ લઈ તેનું થીક અને થીન સ્મીયર તૈયાર કરી અને તેની નોંધ MF.2 રજીસ્ટરમાં કરવી. તેમજ જે તે સ્લાઈડ પર વ્યવસ્થિત કોડ નંબર અને સ્મીયર નંબર અંકિત કરવા.
- (૫) પ્રાયમરી હેલ્થ વર્કરે કાર્યક્ષેત્ર હેઠળનાં વિસ્તારમાં આવતા બાંધકામોનો નિયમીત સર્વે કરવો. તેમજ તેમાં રહેલ મજૂરોની સ્લાઈડ લેવી અને તાવના દર્દીઓને FRT આપવી.
- (૬) પ્રાયમરી હેલ્થ વર્કરે રોજે રોજ વક્કાયરી, HI, BI, CI અને MBER, MPI વીકલી તથા મંથલી મેઈન્ટેઇન કરવાના રહેશે તથા વર્ષનાં અંતે ABER, API વિગેરે મેઈન્ટેઇન કરવાનો રહેશે. Follow up, Contact Smear નું મોનીટરીગ કરવાનું રહેશે.
- (૭) તેણે દરેક ઘરે મેલેરીયા અંગે નીચે મુજબના પાંચ પ્રશ્નો અયુક્ત પુછવા.
  - (i) ઘરમાં કોઈને તાવ છે ?
  - (ii) એક વર્ષથી નાના કોઈ બાળકને તાવ છે ?
  - (iii) છેલ્લા પંદર દિવસમાં કોઈને તાવ હતો ?
  - (iv) ઘરની કોઈ વ્યક્તિએ છેલ્લા પંદર દિવસમાં બહારગામની મુલાકાત લીધેલ ? તેને તાવ આવેલ કોઈ વિનાની રીતે નથી ?
  - (v) ઘરમાં કોઈ મહેમાન આવેલ છે ? તેને તાવ આવે છે ?  
ઉપરાંત કોઈ પણ પ્રશ્નનો જવાબ "હા" માં જણાય તો તેવી વ્યક્તિની સ્લાઈડ લેવી તેમજ FRT આપવી.
- (૮) પ્રાયમરી હેલ્થ વર્કરે મેળવેલ તમામ લોહીની સ્લાઈડોના સંદર્ભે દર્દીને મેલેરીયા નિયંત્રણ માટેની દવા NVBDCP એ સુચવેલ માત્રામાં રૂબરૂમાં જ ગળાવવાની રહેશે.
- (૯) દરેક તાવના કેસને તેણે ફીવર રેડીકલ ટ્રીટમેન્ટ આપ્યા બાદ જરૂર જણાય તો વધુ સારવાર માટે નજીકનાં અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવા જણાવવું.
- (૧૦) પ્રાયમરી હેલ્થ વર્કરે પોતે મેળવેલ લોહીના નમુનાઓ અને વિતરણ કરેલ દવાની માહિતીની MF.2 માં નોંધ કરવી.

- (૧૧) પ્રાયમરી હેલ્પ વર્કરે ડીસ્પોરેબલ લાન્સેટ અને સ્વચ્છ માઈક્રો સ્લાઇડનો જ ઉપયોગ કરવાનો રહેશે, તથા સ્મીયર (થીક અને થીન) વ્યવસ્થિત રીતે બનાવવું.
- (૧૨) પ્રાયમરી હેલ્પ વર્કરે દરેક ઘર ઉપર 'મુલાકાત-કાર્ડ' અવશ્ય લગાવવો અને દરેક પખવાડીક મુલાકાત વખતે સહી કરી તારીખની નોંધ કરવી. બીજી મુલાકાત દરમ્યાન કાર્ડ જોવા ન મળે તો તેવા ઘરો પર નવો કાર્ડ લગાવવાનો રહેશે.
- (૧૩) પ્રાયમરી હેલ્પ વર્કરે ઘરના તમામ પાણી સંગ્રહસ્થાનો/વાસણો ચેક કરવા, તેમજ મચ્છરની ઉત્પત્તિ જણાય તો તેનો નાશ કરવો તેમજ તે ઘરનાં રહીશને નોટિસ પહોંચાડવી.
- (૧૪) પ્રાયમરી હેલ્પ વર્કરે ઘરની પાણી સંગ્રહ કરવા માટેની ઓવરહેડ/અન્ડરગ્રાઉન્ડ/ગ્રાઉન્ડ ટાંકીઓ પર હવાયુસ્ત ઢાંકણ ચેક કરવું. તેમ ન હોય તો હવાયુસ્ત ઢાંકણ બનાવવા માટે નોટિસ આપવી.
- (૧૫) પ્રાયમરી હેલ્પ વર્કરે ઘરની ઓવરહેડ ટાંકીઓના ઢાંકણ સુધી પહોંચવા માટે પડતી અગવડતાના સંદર્ભમાં ઘરના કષજેદારને 'સીડી'(દાદર)ની વ્યવસ્થા કરવા અંગેની નોટિસ પહોંચાડવી.
- (૧૬) પ્રાયમરી હેલ્પ વર્કર દ્વારા આપવામાં આવેલ તમામ 'નોટિસ'નું તેણે બીજી મુલાકાત વખતે ફોલો અપ કરવું, અને જો ખામી દૂર ન થયેલ હોય તો આગળની કાર્યવાહી માટે યુનિટનાં કર્મચારીને જાણ કરવી.
- (૧૭) પ્રાયમરી હેલ્પ વર્કરે તેમના ઉપરી અધિકારીઓ દ્વારા જે સુચનો મળે તે મુજબની કામગીરી કરવાની રહેશે.
- (૧૮) પ્રાયમરી હેલ્પ વર્કરે પીવાના પાણી સિવાય તમામ પાણી ભરેલા ખુલ્લા કન્ટેનરોમાં તેમજ બ્રિડીંગ જણાયેલ કન્ટેઇનરોમાં નિયત ડોઝ મુજબ ટેમ્પેટેરિસની ટ્રીટમેન્ટ આપવાની રહેશે.
- (૧૯) જે તે મિલકતનાં ધાબા/છાપરા/વરંડા પર પડી રહેલ નકામો કાટમાળ/સાધનો/ટાયરો કે જેમાં વરસાદી પાણીના ભરાવાની શક્યતાઓ છે, તેનો સુરક્ષિત સ્થળે નિકાલ કરાવવો.
- (૨૦) ફાઈલેરીયા નાઈટ સર્વેની કામગીરી રજા સિવાયના દિવસોમાં રોજે રોજ બપોરે ૨-૦૦ થી રાત્રે ૧૦-૦૦ દરમ્યાન કરવાની રહેશે. આ ઉપરાંત ટી.પી.એમ. મુજબના વિસ્તારમાં બપોરે ૨-૦૦ થી ૮-૦૦ દરમ્યાન ઘરે ઘરે ફરી, સર્વે દરમ્યાન ફાઈલેરીયા રોગ અંગે જનજાગૃતિ કેળવી, હાઈડ્રોસીલ/લિમ્ફેડીમાના કેસો શોધી મળેલ કેસને મોર્બિડિટી મેનેજમેન્ટ અંગેની સમજજણ હાપવાની રહેશે. રાત્રે ૮-૩૦ થી ૧૦-૦૦ દરમ્યાન અગાઉથી નક્કી કરેલ અમુક અમુક ઘરોમાંથી માઈક્રો ફાઈલેરીયા માટે ૭૫ જેટલા લોહીના નમુના એકત્રિત કરવાના રહેશે.
- (૨૧) જાન્યુઆરીથી જુન માસ દરમ્યાન MBER(Monthly Blood Examination Rate) ચ ૦.૮ % , જ્યારે જુલાઈથી ડિસેમ્બર માસ દરમ્યાન ૧.૨ થી ૧.૮ જેટલો હોવો જોઈએ.
- નોંધ :- સગર્ભા સ્ત્રીઓને તેમજ એક વર્ષથી નાના બાળકોને પ્રિમાકવીન આપવી નહિ.

### **પ્રાયમરી હેલ્પ વર્કર( એન્ટીલાર્વલ કામગીરી )ની ફરજો :-**

- (૧) પ્રાયમરી હેલ્પ વર્કર તેઓની રોજે રોજની કામગીરીની નોંધ રજીસ્ટરમાં રાખવી.
- (૨) દર અઠવાડિયે (સોમવારથી શનિવાર સુધીમાં) એક ટીમે ૨.૫૬ સ્કવેર ક્રિ.મી. વિસ્તારમાં એન્ટીલાર્વલ કામગીરી કરવાની રહેશે. સદર ટીમમાં વિસ્તાર અને વસ્તીના આધારે ૫ થી ૭ ફિલ્ડવર્કરો/બેલદારો રાખી માઈનોર એન્જિનિયરીંગ વર્ક તથા નવા બંધાતા બાંધકામોમાં લાર્વિસાઇડ ટ્રીટમેન્ટ આપવાની રહેશે.
- (૩) દરેક પ્રાઈમરી હેલ્પ વર્કરે તેમને સોંપવામાં આવેલ બેલદારની કામગીરીનું સુપરવીઝન કરવાનું રહેશે. તેના કાર્યક્ષેત્રના વિસ્તારમાં એન્ટીલાર્વલની કામગીરી પરિણામલક્ષી રહે તેની તેણે તકેદારી રાખવાની રહેશે.
- (૪) PHW તેના ફિલ્ડમાં થતી કામગીરીથી પુરેપુરો માહિતગાર હોવો જોઈએ, તેમજ વખતો વખતો વખતો ઉપરી અધિકારી દ્વારા સુચન કરવામાં આવે તે કાર્ય કરાવવું.
- (૫) સમગ્ર કામગીરી માટે તે પોતે અતિ મહત્વની કરી છે, અને એન્ટીલાર્વલની કામગીરીની સફળતાનો મોટો આધાર તેની કામગીરી અને ક્ષમતા ઉપર છે. તેણે તેના કાર્યક્ષેત્ર વિસ્તારના પરમેનન્ટ બ્રિડીંગ સ્પોટ અને ટેમ્પરરી બ્રિડીંગ સ્પોટની માહિતી દર્શાવી યુનિટના ફાઈલેરીયા ઈન્સપેક્ટરને આપવાની રહેશે.


- (૬) તેણે ટોર્ચ, ડીપ, દોરી, રજીસ્ટર હંમેશા પોતાની સાથ રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી તેને નિયત ડોર્જમાં યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરાવવાનો રહેશે.
- (૭) તેને સૌંપવામાં આવેલ સાધન સામગ્રી માટે તે પોતે જવાબદાર રહેશે અને તેની તેણે સંપૂર્ણ કાળજી લેવાની રહેશે.
- (૮) તેને સૌંપવામાં આવેલ બેલદારનાં કામની વહેંચણી તેણે એવી રીતે કરવી જેથી કામગીરી સમયે તે દરેકની કામગીરી ઉપર નિયંત્રણ રાખી શકે, અને જે તે દિવસનો સંપૂર્ણ વિસ્તાર કવર કરી શકાય.
- (૯) તાબા હેઠળ કામદારોની કામની વહેંચણી તેણે એવી રીતે કરવી કે જે તે કામદારની જવાબદારી નક્કી કરી શકાય, કરેલ કામગીરીની નોંધ તેણે તેના કામગીરી રજીસ્ટરમાં અચુક કરવી, અને પોતાના ઉપરી અધિકારી સમક્ષ તે રજૂ કરવી.
- (૧૦) દિવસની કામગીરીના અંતે તાબા હેઠળના કર્મચારી પાસેથી સાધન સામગ્રી પરત મેળવી ફાઈલેરીયા-મેલેરીયા નિરીક્ષક પ્રતિ જમા કરાવવી અને જો સાધનોમાં માઈનોર રીપેરીંગ જરૂરી હોય તો તે તાત્કાલિક કરાવી સાધનો ચાલુ હાલતમાં રાખવા.
- (૧૧) પ્રાયમરી હેલ્થ વર્કરે કોસ ચેકીંગ દરમ્યાન યુનિટના સેનેટરી ઈન્સપેક્ટર/ફાઈલેરીયા ઈન્સપેક્ટરે જણાવેલ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવી, તેમજ દિવસ દરમ્યાન કરવામાં આવેલ કામગીરીનો રિપોર્ટ રોજ રોજ તેમના ઉપરી સુપરવાઇઝરી સ્ટાફને આપવો.
- (૧૨) તેણે ખુલ્લા તમામ પ્લોટો કે જેમાં બ્રિડીંગ થવાની સંભાવના હોય, તેવા પ્લોટના રહીશોને ખાતા તરફથી તૈયાર થયેલ નોટીસ પહોંચાડવાની રહેશે.
- (૧૩) તેણે અન્ટીલાર્વલની કામગીરી દરમ્યાન મળી આવેલ બ્રિડીંગનાં ઘરના રહીશોને ખાતા તરફથી તૈયાર થયેલ નોટીસ પહોંચાડવાની રહેશે.
- (૧૪) તેણે ઘર તેમજ બાંધકામની ઓવરહેડ ટાંકીઓના ટાંકણ સુધી પહોંચવા માટે પડતી અગવડતાના સંદર્ભમાં ઘરના કજ્જેદારને 'સીડી'(દાદર)ની વ્યવસ્થા કરવા અંગેની ખાતા તરફથી તૈયાર થયેલ નોટીસ પહોંચાડવી.
- (૧૫) તેના દ્વારા આપવામાં આવેલ તમામ 'નોટીસ'નું તેણે બીજી મુલાકાત વખતે કોમ્પલાય કરવો, અને જો ખામી દૂર ન થયેલ હોય તો આગળની કાર્યવાહી માટે કચેરીને જાણ કરવાની રહેશે.
- (૧૬) ઉપરી અધિકારી દ્વારા મળતી વખતો વખતની સુચનાનો અમલ કરવાનો રહેશે.

### બેલદાર ની ફરજો :-

- એન્ટી લાર્વલ કામગીરી હેઠળ જંતુનાશક દવાનો સ્પ્રે કરવો તથા ફોર્ગીંગ કરવું.
- તેમને સૌંપેલ વિસ્તારોમાં તમામ પાણીના ભરાવા કે જેનો નિકાલ થઈ શકે તેમ ન હોય ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો.
- નિકાલ થઈ શકે તેવા પાણીના ભરાવાને નીક પાડી પાણીનો નિકાલ કરવો. મોટા જળાશયોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવી.
- ઉપરી અધિકારી તરફથી સૌંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

### કલમ -૪(૧) (ખ) (૩)

દેખરેખ અને જવાબદારીનાં માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યવાહી :—



કેટેગરી	બ	ખ	હ	મ	ભ	રીમાર્ક્સ
અ.નં	કાયમી રાખવા	૩૦/૩૫ વર્ષે રાખવા જોગ	૧૦ વર્ષે રાખવા જોગ	૫ વર્ષે રાખવા જોગ	૨ વર્ષે અથવા ઓરીટ થયેલ (જે પહેલું હોય તે)	
૧	(૧૧) સરકારશીના ઠરાવો જેવા કે મ્યુનિ. ઇલેક્શનને લગતા ઓર્ડર ઠરાવ, રૂલ્સ રેગ્યુલેશન, રેન્ડીગ ઓર્ડર	(૧૦) સર્વિસ બુક	(૧) બીલની ચુકવણી કર્યા અંગેનું રજીસ્ટર	(૫) ટ્રાન્સફર એન્ટ્રી	(૧૮) પટાવાળાની ટપાલબુક	-
૨	(૧૨) અગત્યના કાયમી વહીવટી પરિપત્રો, સ્થાયી આદેશો	(૧૧) શિક્ષા કર્યા અંગેના હુકમો	(૪) પગાર અંગેના બીલો તથા એક્વિટન્સ રોલ	(૩૭) પેન્શન રજીસ્ટર	(૧૯) સ્પેની. સર્વિસમાંથી આપેલ રાજીનામા અંગેના પેપર્સ	-
૩	(૧૩) ડી.પી ઓર્ડર	-	(૫) ગેરહાજરી બાબતનું પત્રક	-	-	-
૪	-	-	(૧૦) કર્મચારીઓના લેબર ટીસ્પયુટ, આઈ.ટી. કેસ સંદર્ભના પેપર્સ	(૪૦) સ્ટોર્સ લેઝર	(૨૨) કાયમી કર્મચારીઓનું મસ્ટર અને સમયપત્રક	-
૫	-	-	-	(૪૧) વર્કઓર્ડર રજીસ્ટર અને બુક	-	-
૬	-	-	-	(૪૩) ઈન્-ટેસ બુક	(૪૬) પેન્શન મેળવતા કર્મચારીઓનું વાર્ષિક સ્ટેટમેન્ટ	-
૭	(૪૪) સુપ્રિમકોર્ટ, હાઇકોર્ટ દારા થયેલ છેવટનાં આદેશો અંગેની ફાઈલો, મ્યુનિ. ઇલેક્શનને લગતા કેસો હોય તો તેના પણ છેવટના આદેશો.	-	-	(૪૬) કેડ સ્ટોક રજીસ્ટર	-	-
૮	(૪૫) બી.સી.ડી. કેટેગરીના નાશ કરવા જોગ કાગળોની મંજૂરી તથા તેનું લિસ્ટ	-	-	-	-	-

### **કલમ –૪(૧)(ખ)(૪)**

પોતાના કાર્યો બજાવવા માટે પોતે નકકી કરેલા ધોરણો :–

નેશનલ ગાઈડ લાઈન મુજબ વાહક જનિત રોગ નિયંત્રણ/અટકાયતની કામગીરી, ફાઈલેરીયા—મેલેરીયા જેવા રોગ નિયંત્રણ / અટકાયવવા માટે લોકજાગૃતિ લાવવા અભિયાન ચલાવવાની કામગીરી.

### **કલમ –૪(૧)(ખ)(૫)**

પોતાના કાર્ય બજાવવા માટે પોતાની પાસેનાં અથવા પોતાના નિયત્રણ હેઠળનાં અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને રેકર્ડ :–

કાર્ય બજાવવા માટે અથવા નિયત્રણ હેઠળના અથવા કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને રેકર્ડ વિગેરે સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે

### **કલમ –૪(૧)(ખ)(૬)**

પોતાની પાસે અથવા પોતાના નિયત્રણ હેઠળ હોય એવા દસ્તાવેજનું વગ્નિકરણ પત્રક :–

નિયત્રણ હેઠળ હોય એવા દસ્તાવેજોનું વગ્નિકરણ સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે.

કુટેગરી	બ	ખ	હ	મ	ભ	રીમાર્ક્ઝ
અ. નૂ.	કાયમી રાખવા	૩૦/૩૫ ન્ય રાખવા જોગ	૧૦ વર્ષે રાખવા જોગ	૫ વર્ષે રાખવા જોગ	૨ વર્ષે અથવા ઓડીટ થયેલ (જે પહેલું હોય તે)	
૮.	—	—	—	(૫૭)મસ્ટર રોલ (૨૦૧૬-૨૦૨૦)	—	—
૧૦.	—	—	—	(૫૮)સ્ટોક ૨જીસ્ટર (૨૦૧૬-૨૦૨૦)	—	—
૧૧.	—	—	—	(૫૯)ઇનવર્ડ આઉટવર્ડ ૨જીસ્ટર (૨૦૧૬-૨૦૨૦)	—	—
૧૨.	—	—	—	—	—	—
૧૩.	—	—	—	(૬૪)પેન્શન ગ્રેજ્યુએટ્ટીનો સંમતિ આપતા પેપર્સ	—	—
૧૪.	—	—	—	(૬૫)હંગામી અને કામચલાઉ કર્મચારીઓના પેપર્સ	—	—
૧૫.	—	—	—	—	—	—
૧૬.	—	—	—	—	—	—
૧૭.	—	—	—	(૬૬)હાલનાં પગારધોરણ અને સીનીયોરીની મુજબ તૈયાર કરેલ કર્મચારીઓનું લીસ્ટ	—	—
૧૮.	—	—	—	(૭૦)કર્મચારીઓ પાસેની વસુલાત : પુરેપુરી થયેલ વસુલાત અંગેની સેવાપોથીમાં નોંધ કરવા બાબત.	—	—
૧૯.	—	—	—	(૭૧)વિશેષ કામગીરી બદલ આપવામાં આવેલ પ્રશંસાપત્ર કે ભેટ બાબતેની નોંધ સેવાપોથીમાં નોંધ કરવા બાબત	—	—
૨૦.	—	—	—	(૭૮)ઠરાવ ૨જીસ્ટર	—	—
૨૧.	—	—	—	(૮૨)ચુનિ. એકટ, નિયમ, વિનિયમમાં થયેલ ગુનો બાબતેની ફરીયાદને લાગત પત્રવ્યવહાર	—	—
૨૨.	—	—	—	(૮૨)ફરીયાદ ૨જીસ્ટર	—	—
૨૩.	—	—	—	(૮૩)વિભાગીય વડા કે ચીફ ઓફિસરનો વહીવટી રીપોર્ટ.	—	—
૨૪.	—	—	—	—	—	—

### કલમ –૪(૧)(ખ)(૭)

તેની નિતી ઘડતરના અથવા તેના અમલીકરણનાં સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર અને વિનિમય માટે અથવા તેના ધ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ વ્યવસ્થાની વિગતો :–

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયुક્ત છે

### કલમ –૪(૧)(ખ)(૮)

તેના ભાગ તરીકે અથવા તેની સલાહનાં હેતુઓ માટે બે અથવા બે થી વધુ વ્યક્તિત્વોનાં બનેલા બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક, અને તે બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ :–

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયुક્ત છે

### કલમ –૪(૧)(ખ)(૯)

તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :–

બી.સી.એન.ટી. વાઈજ અધિકારી અને કર્મચારીઓની માહિતી [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) ૫૨ સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે તથા અત્રેના ખાતાના કર્મચારીઓનાં મહેકમ, દફ્તર તથા પગાર રજીસ્ટરની નકલ ખાતામાં ઉપલબ્ધ છે.

### કલમ –૪(૧)(ખ)(૧૦)

તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓને અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણા :–

બી.સી.એન.ટી. વાઈજ અધિકારી અને કર્મચારીઓની માહિતી [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) ૫૨ સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે તથા અત્રેના ખાતાના કર્મચારીઓનાં મહેકમ, દફ્તર તથા પગાર રજીસ્ટરની નકલ ખાતામાં ઉપલબ્ધ છે.

### કલમ –૪(૧)(ખ)(૧૧)

તમામ યોજનાઓ સુચિત ખર્ચ, ચુકવેલ નાણા પરના અહેવાલોની વિગતો દર્શાવતુ અંદાજપત્ર :–

બી.સી.એન.ટી. વાઈજ અધિકારી અને કર્મચારીઓની માહિતી [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) ૫૨ સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે

### કલમ –૪(૧)(ખ)(૧૨)

ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યકરોની અમલ બજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો :–

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયुક્ત છે અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

### કલમ –૪(૧)(ખ)(૧૩)

તેણે આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવારાની વિગતો :–

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

### કલમ –૪(૧)(ખ)(૧૪)

ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતીઓને લગતી વિગતો :–

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે

### કલમ –૪(૧)(ખ)(૧૫)

જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલયની અથવા તેના વાંચનકષના કામકાજનાં કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગત :–

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે

### કલમ –૪(૧)(ખ)(૧૬)

જાહેર માહિતી અધિકારીઓનાં નામો, હોદ્દો અને બીજી વિગતો :–

સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે

### કલમ –૪(૧)(ખ)(૧૭)

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :–

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે

- (૧) જુલાઈ થી સપ્ટેમ્બર – ૨૦૨૦ ૨જીસ્ટર નમુનો – ૧
- (૨) ઓક્ટોબર થી ડિસેમ્બર – ૨૦૨૦ ૨જીસ્ટર નમુનો – ૧
- (૩) જાન્યુઆરી માર્ચ – ૨૦૨૧ ૨જીસ્ટર નમુનો – ૧
- (૪) એપ્રિલ થી જુન – ૨૦૨૧ ૨જીસ્ટર નમુનો – ૧
- (૫) જુલાઈ થી સપ્ટેમ્બર – ૨૦૨૧ ૨જીસ્ટર નમુનો – ૧

જંતુનાશક અધિકારી  
વી.બી.ડી.સી વિભાગ  
સુરત મહાનગરપાલિકા

## વेबसाईट पર માહિતી અધતન હોવા બાબતનું પ્રમાણપત્ર

સાદર ૨જુ,

**Sub :- વેબસાઈટ ([www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in)) પર માહિતી અધતન હોવા બાબતનું  
પ્રમાણપત્ર**

આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગને લગતી માહિતી તમામ લાગત માહિતી જેવી કે પ્રોજેક્ટની વિગત, અધિકારી-કર્મચારીની માહિતી, RTI અંતર્ગત પ્રોએક્ટીવ ડિસ્કલોઝર, વિગેરે અત્રેથી ચકાસવામાં આવેલ છે અને તે તા. ૧૬/૧૨/૨૦૨૧ મુજબ અધતન છે.

વેબસાઈટ અપડેટ બાબતનું આ પ્રમાણપત્ર મે. ડેયુટી કમિશનરશ્રી(હે. અને હો.) મારફતે ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ વિભાગને મોકલાવવા મંજૂરી મળવા વિનંતી.

જંતુનાશક અધિકારી  
વી.બી.ડી.સી વિભાગ

દી.ચા. નાયબ આરોગ્ય અધિકારીશ્રી (સર્વેલન્સ)

આરોગ્ય અધિકારીશ્રી

ડેયુટી કમિશનરશ્રી(હે. અને હો.)  
સુરત મહાનગરપાલિકા

સ.૨. આઈ.એસ.ડી. સુપરવાઈઝરશ્રી પ્રતિ,

કે.કમિશનરશ્રી(સી) ના નોંધ નં.એસએમસી/આઈએસડી/ઓડી/નં.૧૧૬૨, તા.૦૭/૧૨/૨૦૨૧  
અન્વયે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબની પ્રો એક્ટિવ ડીસ્કલોઝર અંગે વીબીડીસીડીની  
વિગતો દર્શાવતી માહિતી અધતન હોવા બાબતનું પ્રમાણપત્ર આ સાથે સામેલ છે. જે આપશ્રીની જાણ માટે.

નં. પીએચી/આઈઓ/  
તારીખ:-

જંતુનાશક અધિકારી  
વી.બી.ડી.સી વિભાગ  
સુરત મહાનગરપાલિકા

સ.૨. આઈ.એસ.ડી. સુપરવાઈઝરશ્રી પ્રતિ,

કે.કમિશનરશ્રી(સી) ના નોંધ નં.એસએમસી/આઈએસડી/ઓડી/નં.૧૧૬૨, તા.૦૭/૧૨/૨૦૨૧  
અન્વયે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબની પ્રો એક્ટિવ ડીસ્કલોઝર અંગે વીબીડીસીડીની  
વિગતો દર્શાવતી માહિતી અધતન હોવા બાબતનું પ્રમાણપત્ર આ સાથે સામેલ છે. જે આપશ્રીની જાણ માટે.

નં. પીએચી/આઈઓ/  
તારીખ:-

જંતુનાશક અધિકારી  
વી.બી.ડી.સી વિભાગ  
સુરત મહાનગરપાલિકા

**વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ મુખ્ય કચેરી ખાતે ફરજ બજાવતાં અધિકારી/કર્મચારીઓની માહિતી**

**દર્શાવવાનું પત્રક-૨**

અ.નં.	અધિકારી/કર્મચારીનું નામ કર્મચારી નંબર	હોદ્દો	હાલનું સરનામું / મોબાઈલ નંબર	રીમાર્ક્સ
૧	શ્રી ડૉ. કે. જી. વૈષણવ, કર્મ.નં. ૧૭૧૬૫	જંતુનાશક અધિકારી	એ/૭, પ્રથમ રો-હાઉસ, હનીપાર્ક રોડ, સરસ્વતી સ્કૂલની પાસે, અડાજણા, સુરત મો.નં. ૮૭૨૪૩ ૪૫૪૮૦	
૨	શ્રી સંગીતા હિપકુમાર પટેલ કર્મ.નં. ૧૦૮૫૦	સેક્શન ઓફિસર	ડી-૧૧-૧૨, ઉમાપાર્ક સોસાયટી, ટી.જી.બી. હોટલની પાસે, એલ.પી.સવાણી રોડ, અડાજણા, સુરત. મો.નં. ૮૪૨૭૬ ૪૪૮૨૫	
૩	શ્રી ઈલાબેન નૈલેશકુમાર દેસાઈ કર્મ.નં. ૧૧૮૩૪	પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક	એ/૨૦૫, નિત્યાનંદ એપા., કહાન ફણિયું, કતારગામ, સુરત-૩૮૫૦૦૪ મો.નં. ૮૪૨૭૧ ૬૫૦૫૬	
૪	શ્રી સંજયકુમાર રમેશયંદ્ર મેવાવાલા, કર્મ.નં. ૧૮૭૯૦	સેનેટરી ઇન્સપેક્ટર	સી/૫૫-૫૬, સમરપણ કો.ઓ.હા.સો., ચોકસી વાડીની પાસે, અડાજણા, સુરત, મો.નં. ૮૮૨૪૭ ૦૨૦૦૧	
૫	શ્રી ધનસુખભાઈ મગનભાઈ આહીર, કર્મ.નં. ૧૫૬૬૪	સેનેટરી ઇન્સપેક્ટર	કુટેગરી-૨, બ્લોક નં. ૧, રૂમ નં. ૧, મ્યુ. સ્ટાફ કવાર્ટ્સ, અલથાળ, સુરત. મો.નં. ૮૪૨૭૧ ૨૨૭૭૧	પી.એસ.યુ. લેબમાં ફરજ બજાવે
૬	શ્રી મેહુલ મનોજકુમાર દેસાઈ, કર્મ.નં. ૧૮૭૧૪	સેનેટરી ઇન્સપેક્ટર	બી/૧-૧૦૦૫, શ્રીન સીટી, ભાગાગમની પાસે, પાલ, અડાજણા, સુરત. મો.નં. ૮૮૮૮૮૮ ૮૮૬૪૩	
૭	શ્રી મુકુલકુમાર છોટુભાઈ વશી કર્મ. નં. ૧૮૬૭૮	સેનેટરી ઇન્સપેક્ટર	એ.પો.ધીણમ, વાયા મરોલી બજાર, તા.જલાલપોર, ડી.સુરત. ઉદ્દ્રોહ ૮૫૬૪૭ મો.નં. ૮૮૨૪૦ ૭૨૫૮૬	
૮	શ્રી કેયુપકુમાર હર્ષદરાય પટેલ કર્મ. નં. ૩૨૦૩૫	સેનેટરી ઇન્સપેક્ટર	એ/૧૦૧, સંકૃતિ કોમ્પ્લેક્સ, જહાંગીરપુરા, સુરત-૩૮૫૦૦૫ મો.નં. ૮૮૨૪૫૦૫૨૨૮૧	
૯	શ્રીમતી ભારતીબેન કનુભાઈ પટેલ, કર્મ. નં. ૪૦૧૫૫,	બીજી શ્રેષ્ઠી કલાર્ક	પટેલ ફણિયું, મુ.પો.ભટલાઈ, તા.ચોર્યાસી, જી.સુરત. મો.નં. ૮૭૨૪૩ ૭૮૮૮૮	
૧૦	શ્રી ઉધાબેન નાથુભાઈ પટેલ કર્મ. નં. ૧૨૩૬૬	લેબ. ટેકનીશયન	૨૧, પ્રેરણાનગર સોસા., તાડવાડી, રાંદેર રોડ, સુરત. મો.નં. ૮૫૧૧ ૧૭૫૦૫	
૧૧	શ્રી રૂપલબેન ચેતન પંડ્યા કર્મ. નં. ૧૩૬૮૧	લેબ. ટેકનીશયન	૧૪૧, દિવાળીબાગ સોસા., રૂપભ એપા. પાસે, રાંદેર રોડ, સુરત. મો.નં. ૮૮૮૨૫૮૦૪૫૫૨, ૮૮૨૫૧ ૪૪૮૮૪, ૮૮૨૪૭૮૫૮૪૪૮	
૧૨	શ્રી કૃતીદાબેન હેમતકુમાર ભાટપોરવાલા કર્મ. નં. ૧૯૮૭૭	લેબ. ટેકનીશયન	એ-૨૩, ગોવંધન પાર્ક સોસાયટી, ડી-માર્ટની પાછળ, અડાજણા, સુરત. મો.નં. ૮૮૭૯૮૨ ૪૪૮૮૬	
૧૩	શ્રી જાગૃતિબહેન વિકી જોઘી કર્મ. નં. ૧૮૮૭૮	લેબ. ટેકનીશયન	"માવતર" ૭૨, શાંતિકુંજ સોસા., પાલનપુર જાકાતનાકા, સુરત. મો.નં. ૮૩૭૪૦ ૪૩૮૮૪, ૮૩૭૪૭ ૧૮૨૫૪	
૧૪	શ્રી પ્રાચી ગૌરાંગભાઈ વૈધ, કર્મ નં. ૧૮૭૮૮	લેબ. ટેકનીશયન	"એ"/૫૦૩, નીલકંઠ રેસીડેન્સી, એસ.એમ.સી.પાર્ટી લોટની બાજુમાં શ્રીન સીટી રોડ, પાલ, સુરત. મો.નં. ૮૮૮૨૫૨ ૦૭૦૪૮	
૧૫	શ્રી ચેતનભાઈ દેવશીભાઈ ચૌહાણ, કર્મ. નં. ૧૮૫૧૦	લેબ. ટેકનીશયન	૫, વૃંદાવન નગર, ડભોલી ચાર રસ્તા, વેડ રોડ, સુરત. મો.નં. ૮૫૧૧ ૧૧૮૩૩	
૧૬	શ્રી કેલાસબેન જયસુખલાલ કોઠીયા, કર્મ. નં. ૩૦૨૪૫	લેબ. ટેકનીશયન	૫, ઝાંખીલોઝ, બોભેમાકેટની પાછળ, બોભે માર્કેટ થી પુણ્યાગમ રોડ, સુરત. મો.નં. ૮૮૦૮૦ ૦૮૧૩૭	
૧૭	શ્રી ધૂની રાજેશકુમાર વૈધ કર્મ. નં. ૩૨૦૬૩	લેબ. ટેકનીશયન	બીલીંગ નં.બી-૨/૧૮, ફ્લેટ નં. ૬૦૧, શ્રીન સીટી, ભાડા, સુરત. મો.નં. ૮૪૬૪૫૬૦૬૧૫	
૧૮	શ્રી મનીષા કેતન દેસાઈ કર્મ. નં. ૩૨૦૭૫	લેબ. ટેકનીશયન	બી/૭૦૨, શાલીગ્રામ પાર્ક ટી.જી.બી.હોટેલ પાસે, શ્રીન એવેન્યુની પાછળ, એલ.પી.સવાણી રોડ, સુરત. મો.નં. ૮૮૨૪૩ ૬૮૮૨૫૮, ૬૫૫૩૦૪૨૨૦૨	
૧૯	શ્રી નિલમ્બરી સતીષકુમાર પરમાર, કર્મ. નં. ૩૪૦૧૯	લેબ. ટેકનીશયન	૪, જાનકી રો-હાઉસ, પિનલ રો-હાઉસની સામે, પાલનપુર પાઠીયા, સુરત. મો.નં. ૮૫૦૧૨ ૮૭૦૮૫	
૨૦	શ્રી અરુણાબેન કનકભાઈ વૈધ કર્મ. નં. ૩૪૭૩૧	લેબ. ટેકનીશયન	૨૦૧/એ આનંદ વાટિકા એપાર્ટમેન્ટ વાટિકા એપાર્ટમેન્ટ, ગોરાટ હનુમાન મંદિર રોડ તાડવાડી, સાયમ શિવમ એપાર્ટમેન્ટની ગલીમાં સુરત. મો.નં. ૮૪૨૭૮ ૧૫૨૧૨	
૨૧	શ્રી મેધાબેન જતિન રેશમવાલા કર્મ. નં. ૩૪૭૮૩	લેબ. ટેકનીશયન	૧૫, સહજધામ સોસાયટી, ગોવિંદનગરની બાજુમાં હનીપાર્ક રોડ, અડાજણા, સુરત-૮ મો.નં. ૮૬૦૧૨ ૮૭૦૭૪	
૨૨	શ્રી ધનશ્યામભાઈ ભીમજીભાઈ સવાણી, કર્મ. નં. ૩૪૭૮૪	લેબ. ટેકનીશયન	ડી-૫, સુરધન સીટી હોમ્સ, આઈ માતા રોડ, એસબીઆઈ પાસે, મગાબ સુરત-૩૮૫૦૧૦ મો.નં. ૮૮૨૪૧૪૫૨૭૮	

૨૩	શ્રી ફાલગુની ધર્મેશકુમાર દેસાઈ કર્મ. નં. ૭૫૨૭૬	લેબ. ટેકનીશયન	૮૫/બી, સર્જન સોસાયટી, સાઈન્સ સેન્ટર સામે, ન્યૂ સીટીલાઈટ રોડ, સુરત. મો.નં.૮૮૦૪૪ ૪૫૦૮૮	
૨૪	શ્રી નેહા ધર્મેશકુમાર પટેલ કર્મ. નં. ૭૫૨૮૮	લેબ. ટેકનીશયન	બી-૫, શાંતિનીકેતન રો-હાઉસ, સેહ સંકુલ વાડીની સામે, આનંદ મહલ રોડ, સુરત. મો.નં.૮૮૨૫૦ ૩૩૩૬૦	
૨૫	શ્રી નીતાબેન હરીશભાઈ ચાવડા, કર્મ. નં.૭૫૫૫૧	લેબ. ટેકનીશયન	૧૦, પ્રયોગરાજ રો-હાઉસ પ્રાઇમ માર્કેટ પાસે, આનંદમહલ રોડ, સુરત. મો.નં.૮૮૭૮૬ ૮૬૩૫૫ ૮૧૪૧૪ ૧૮૨૪૭	
૨૬	શ્રી સુમીત્રાબેન બુકુલભાઈ ચોડવીયા, કર્મ. નં.૭૮૨૭૬	લેબ. ટેકનીશયન	બી-૧૩,ગોપીનાથ સોસા.સવજી કોરાટ પુલ,મોટા વરાણી, સુરત. મો.નં. ૮૮૭૮૩ ૮૭૨૩૬	
૨૭	શ્રી મનીષાબેન તેજસ મોતીવાલા કર્મ. નં. ૪૦૧૫૭	લેબ. ટેકનીશયન	૧૦૩, સીધીગીરી ટાવર, નવયુગ કોલેજની પાછળ, રાંદેર રોડ, સુરત. મો.નં.૮૮૭૮૮ ૨૩૩૩૧ ૮૮૭૮૩ ૮૭૨૩૬	
૨૮	શ્રી માનસી સાવનકુમાર પટેલ કર્મ. નં. ૪૦૧૫૮	લેબ. ટેકનીશયન	ડી-૩/૩૭, કિશોરપાઈ સોસા., સેન્ટ જીવીયર સ્કુલની પાછળ, ઘોડાડ રોડ, સુરત. મો.નં.૮૮૭૮૯ ૧૩૩૮૮, ૯૭૭૩૦ ૫૧૩૦૧	
૨૯	શ્રી રૂપલ પિયુષ ૧૪૪૨ કર્મ. નં. ૪૦૪૭૨	લેબ. ટેકનીશયન	૪૦૪,દેવ ભૂમી એપા.સરદાર બ્રીજની નજીક,અડાજણા,સુરત.મો.નં.૮૮૨૪૭ ૮૫૮૪૮	
૩૦	શ્રી ફાલગુની સમીર પટેલ કર્મ. નં. ૪૦૪૭૬	લેબ. ટેકનીશયન	બી/૧ ૧૮, આશીષ રો.હાઉસ, જહાંગીરપુરા, વરીયાવ-રોડ,સુરત.મો.નં.૮૮૭૮૧ ૦૬૪૪૦	પી.એસ.યુ. લેબમાં ૯૨૪ બજાવે
૩૧	શ્રી જ્યેશકુમાર હસમુખભાઈ નાયક, કર્મ. નં. ૧૮૪૦૨	સેનેટરી સબ ઇન્સ્પેક્ટર	મુ.પો.નિયોલ, તા.પલસાણા, જી. સુરત મો.નં.૮૭૨૪૩ ૩૧૮૭૪	
૩૨	શ્રી નેનેશ રજનીકાંત શાહ કર્મ. નં. ૩૪૪૬૮	સેનેટરી સબ ઇન્સ્પેક્ટર	૫૦૬, ગાઈન હાઈટ્સ એપાર્ટમેન્ટ, સહજ સુપર સ્ટોર પાસે, આનંદ મહેલ રોડ, અડાજણા,સુરત મો.નં.૮૮૭૮૫ ૬૪૩૨૩	કોસાડ યુનિટ ખાતે ૯૨૪ બજાવે
૩૩	શ્રી વિપુલકુમાર મનહરલાલ સોલંકી, કર્મ. નં. ૩૮૩૦૪	સેનેટરી સબ ઇન્સ્પેક્ટર	૫૦૬, ગાઈન હાઈટ્સ એપાર્ટમેન્ટ, સહજ સુપર સ્ટોર પાસે, આનંદ મહેલ રોડ, અડાજણા,સુરત મો.નં.૮૭૧૪૮૪૮૦૦૦	
૩૪	શ્રી કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ કર્મ. નં. ૪૭૬૩૧	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	મુ. પો. અણીના, બ્રાચણ ફણિયું, વાયા. કીમ તા. ઓલપાડ, જી. સુરત ૩૮૪૧૧૦, મો.નં. ૭૩૫૮૮૧૮૨૮૩	
૩૫	શ્રીમતી કુસુમબેન મહેશભાઈ પટેલ,કર્મ. નં. ૪૭૬૩૨	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	મુ. પો. વરિયાવ, બ્રાચણ ફણિયું, તા.ચોર્યાસી, જી.સુરત-૩૮૪૫૨૦. મો.નં.૮૮૭૮૪૬૩૭૭૯	
૩૬	શ્રી પ્રશ્નેશકુમાર જીતેન્દ્રભાઈ સોલંકી, કર્મ. નં.૪૭૮૭૧	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	ડી-૮, સાર્થક રો-હાઉસ, પાલનપુર જકાતનાકા, મીની વિરપુર રોડ, સુરત - ૩૮૫૦૦૮, મો.નં.૮૮૭૮૮૧૦૪૮૫	
૩૭	શ્રી ભાવિનકુમાર વિનોદચંદ્ર પંચાલ, કર્મ. નં.૪૮૦૦૫	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	એચ-૬૦૩, અવન્તીકા કો.ઓ.સો., પ્રગતિનગર, પીપલોડ જકાતનાકા, પીપલોડ, સુરત-૩૮૫૦૦૧ મો.નં.૮૮૦૮૦૭૮૫૫૭	
૩૮	શ્રી વિજયકુમાર લક્ષ્મીદાસ ટાંક કર્મ. નં. ૪૮૨૦૮	ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	આઈ-૪૦૪, સ્વર્ગ રેસીડેન્સી, પાસોદરા પાટીયા, ઓલવડ રોડ, ઓલવડ. મો.નં.૮૬૬૨૭ ૪૭૨૬૦	
૩૯	શ્રીમતી તન્વીબેન વિજયસિંહ ઠાકોર, કર્મ. નં.૮૮૧૫૫	તાલીમાર્થી ત્રીજી શ્રેષ્ઠી કલાર્ક	જે-૨૦૩, અંજની રેસીડેન્સી, ઇસ્કોન મંદિરની સામે, જહાંગીરપુરા, સુરત. મો.નં.૮૮૨૫૬ ૧૫૫૧૪	
૪૦	શ્રી રમેશકુમાર રામશંકર ત્રિવેદી કર્મ. નં. ૩૪૦૫૭	ડ્રાયવર	એફ/૫૦૨, સ્વસ્તિક એવેન્યુ, એલ.પી.સવાણી સ્કુલ પાસે. નક્ષત્રની બાજુમાં પાલ રોડ, સુરત. મો.નં.૮૪૨૮૮૪૨૮૭૭૮	પી.એસ.યુ. લેબમાં ૯૨૪ બજાવે
૪૧	શ્રી જ્યેશકુમાર શાંતિલાલ પવાર કર્મ. નં. ૪૦૫૫૨	ડ્રાયવર	એ-૨-૨૨, શ્રી સાંઈ કૂપા પાર્ક એપાર્ટમેન્ટ, અલથાણ રોડ, શ્રી રામ મારબલની પાસે, સુરત-૩૮૫૦૧૭. મો.૮૮૧૩૭૮૮૩૭૦	વેક્સીનેશન બ્રાંચમાં ૯૨૪ બજાવે
૪૨	શ્રી ઈશ્વરલાલ જ્યંતિલાલ પટેલ, કર્મ. નં.૪૮૮૮૦	ડ્રાયવર	જપીસાથ મહોલ્લો, મુ.દિલેણ,તા.ઓલપાડ જિ. સુરત મો.નં.૮૮૦૮૬ ૬૫૩૪૫	સાઉથ ઝોન (ઉધના) ખાતે ૯૨૪ બજાવે
૪૩	શ્રી અણ્ણિબન કુલુભા જાલા કર્મ. નં. ૧૭૫૩૪	પ્રા.એ.વ	૨૪૪,મહાવીરધામ સોસા.વિ-૨,નવો કોસાડ રોડ,અમરોલી,સુરત. મો.નં.૮૮૭૮૩૧૪૪૫૨	
૪૪	શ્રી તુપાર જ્યંતિલાલ દેસાઈ કર્મ. નં. ૧૮૪૩૩	પ્રા. એ. વ.	૨૦, શાંતિનિકેતન સોસાયટી, સુમુલ ડેરી રોડ, સુરત. મો.નં.૮૮૨૪૨ ૫૩૭૮૭,૮૬૦૧૨ ૮૭૬૪૪	
૪૫	શ્રી દેવાંગ કિશોરભાઈ દેસાઈ કર્મ. નં. ૧૮૪૪૫	પ્રા. એ. વ.	૮૩, નીલકંદ સોસાયટી, રામકુંવરબા વિદ્યાલય પાસે, છાપરાભાઈ રોડ, અમરોલી, સુરત. ઉદ્ધેની ૧૦૫૦૫ મો.નં.૮૮૧૩૩૭૪૫૨૭	
૪૬	શ્રી પ્રકાશકુમાર સુમંતરાય રાવલ, કર્મ. નં. ૧૮૪૪૮	પ્રા. એ. વ.	ગાયત્રી નગર, વિજલપુર રોડ, નવસારી. ૮૮૨૪૮૩૧૮૪૮	સ્પીમેર હોસ્પિટલ ખાતે ૯૨૪ બજાવે
૪૭	શ્રી સુરેશકુમાર જામલભાઈ પટેલ, કર્મ. નં. ૧૮૪૫૩	પ્રા. એ. વ.	૧ ઉંડ, જ્યંજલારામ સોસાયટી, જહાંગીરપુરા, જીન પેટ્રોલ પંપની સામે, સુરત. મો.નં.૮૮૨૫૦ ૧૦૫૮૮	

૪૮	શ્રી પંકજકુમાર છગનલાલ લાડ કર્મ. નં. ૧૯૪૬૩	પ્રા. હે. વ.	૧૦, અંબિકાનગર સોસાયટી, હાઈસ્કુલ ની પાછળ, એ.પો.સાયણ, તા.ઓલપાડ, જી.સુરત -૩૮૪૧૩૦. મો.નં.૮૮૭૫૪૬૪૫૬	
૪૯	શ્રી શૈલેન્દ્રકુમાર ઠોટાલાલ વાડીવાલા, કર્મ. નં. ૧૯૪૭૩	પ્રા. હે. વ.	૨૦૧, પાર્થ કોમ્પ્લેક્સ, તાડવાડી, ન્યૂ રાંદેર રોડ, સુરત -૩૮૫૦૦૮. મો.નં.૮૮૭૮૦૬૨૨૪૮	ઉમરવાડા યુનિટ (સેન્ટ્લઝોન) ખાતે ૬૨૪ બજાવે
૫૦	શ્રી કલ્પેશકુમાર અમૃતલાલ ચાંપાનેરીયા, ૧૯૪૮૮	પ્રા. હે. વ.	બી/૨-૪૦૩, સિમત રેસીડન્સી, પાનલપુર ગામ, સુરત. મો.નં.૮૮૨૪૫૮ ૩૩૨૫૨	
૫૧	શ્રી ઉમેશકુમાર મોરારભાઈ પટેલ, કર્મ. નં. ૧૯૫૦૨	પ્રા. હે. વ.	મુ.પો. વાવ, પટેલ ફળિયા, તા. કામરેજ, જી. સુરત ૩૮૪ ૩૨૬. મો.નં.૮૮૧ ૩૪ ૩૧૪૬૬	ઇસ્ટેઝન (વરાણી) ખાતે ફરજ બજાવે
૫૨	શ્રી રવિન્દ્રકુમાર મોહનલાલ પટેલ, કર્મ. નં. ૧૯૮૬૫	પ્રા. હે. વ.	બી-૩, ૩૦૨, સુર્યાંગ્લી રેસીડન્સી, કોંસ રોડ, કોસાડ, સુરત -૩૮૪૧૦૭. મો.નં.૮૭૨૪૩૧૬૮૨૨	
૫૩	કુમલેશકુમાર ઈશ્વરભાઈ ઢીમર, કર્મ.નં. ૭૪૩૬૬	પ્રા. હે. વ.	એ.પો.નિહાલી, ધોળીકુઈ, પંચાયત હાઉની પાછળ, તા.મહુરુવા, ડી.સુરત-૩૮૪૨૫૦, મો.નં.૮૧૭૩૦૮૮૬૧૫	
૫૪	શ્રી પ્રવિષ્ણસિંહ ભીખુસિંહ પરમાર, કર્મ. નં. ૭૪૪૩૧	પ્રા. હે. વ.	એ/૨૦૭, શ્રીજી કોમ્પ્લેક્સ, જીઆવ બુડીયા રોડ, ભેસ્તાન બસ સ્ટેન્ડ પાસે, સુરત ઉદ્ઘોષ મો.નં.૮૭૨૪૩ ૩૨૪૮૭	સ્મીમેર હોસ્પિટલ ખાતે ફરજ બજાવે
૫૫	શ્રી અજીત પાનીયાભાઈ ગામીત કર્મ. નં. ૭૪૪૩૪	પ્રા. હે. વ.	૫૩૪, મહાદેવ નગર-૧, નવગામ, ડીડોલી, ઉધના સુરત. ઉદ્ઘરૂઠો ૩૦૧૦ મો.નં.૮૬૦૧૨ ૮૬૪૫	
૫૬	શ્રી મોહમદઆરીફ જી. મન્સુરી કર્મ. નં. ૭૪૪૩૫	પ્રા. હે. વ.	૪/૩૦૨૩, બેગમપુરા અહંમદ નધીલ સ્ટ્રીટ, સુરત ૩૮૫૦૦૩. મો.નં. ૮૫૧૧૧ ૦૬૦૫૮	પાંડેસરા યુનિટ ખાતે ૬૨૪ બજાવે
૫૭	શ્રી સુનિલભાઈ ખુશાલભાઈ પટેલ, કર્મ. નં. ૭૪૪૫૬	પ્રા. હે. વ.	એ-૧૧, શાંતિનગર રોડ, માનેત્ર હોસ્પિટલની સો, બારડોલી ઉદ્ઘરૂઠો ૩૦૨૬૦૧. મો.નં.૮૮૮૨૫૨ ૨૩૦૨૬	
૫૮	શ્રી જેમ્સ જોન મેકવાન કર્મ. નં. ૭૪૪૬૦	પ્રા. હે. વ.	જેમ્સ વીલા, પંચ ફાન્સ ટોસ્ટ ઓફિસ, કોનવેન્ટ સ્કુલની સામે, એસ.ટી. રોડ, ભરૂચ-૩૮૨૧૦૧ મો.નં.૮૭૨૭૭ ૨૦૦૦૪	બેગમપુરા યુનિટ (સેન્ટ્લઝોન) ખાતે ૬૨૪ બજાવે
૫૯	શ્રી સંદિપકુમાર સરદભાઈ નાયક, કર્મ. નં. ૭૪૬૫૨	પ્રા. હે. વ.	એ.પો. પોંસરા, મોબ ફળિયા, તા. જલાલપોર જી. નવસારી. મો.નં.૮૮૭૮૦૬૮૪૬૪	દુંભાલ સ્ટોર ખાતે ૬૨૪ બજાવે
૬૦	શ્રી કૌશિકભાઈ જગદીશભાઈ દેસાઈ, કર્મ. નં. ૭૪૮૫૨	પ્રા. હે. વ.	મુ.પો. મોતા, તા. બારડોલી, જી. સુરત મો.નં.૮૮૮૮૨૫૨ ૨૭૫૪૬	દુંભાલ સ્ટોર ખાતે ૬૨૪ બજાવે
૬૧	શ્રીમતી સેજલ સુનિલકુમાર પટેલ, કર્મ. નં. ૮૦૪૮૪	પ્રા. હે. વ.	પોલ સ્ટ્રીટ, સરી ખુજરંગ પો.અમલસાડ, તા. ગણાંદેવી, જી. નવસારી ઉદ્ઘરૂઠો ૩૧૬૩૧૦. મો.નં.૮૫૧૧૧૮૭૮૫	
૬૨	શ્રી ચેતન પ્રકાશ મહાજન કર્મ. નં. ૮૪૮૬૩	પ્રા. હે. વ.	ડી/૮૨/૪, સરસ્વતી સોસાયટી-૩, શારદા સ્કુલની પાસે, સિંગાણપોર કોઝેવે રોડ, સુરત -૩૮૫૦૦૪ મો.નં.૮૧૪૧૩ ૮૭૨૪૪	
૬૩	શ્રી બ્રિજેશકુમાર અશોકભાઈ ગામીત, કર્મ. નં. ૮૪૮૬૭	પ્રા. હે. વ.	એ-૪, અંબિકા નગર, એ.પો.તાડકુવા, તા.વ્યારા, જી.તાપી-૩૮૪૬૫૦ મો.નં.૮૫૩૭૨૧ ૬૨૧૧, ૭૦૧૬૨૮૬૬૬૪	
૬૪	શ્રી સતિશભાઈ પ્રતાપભાઈ પરમાર, કર્મ. નં. ૮૪૮૬૭૮	પ્રા. હે. વ.	૧૦૭, વિરજપાર્ક પાર્ક એપાર્ટમેન્ટ, રૂમ નં -૩, દેસાઈ ફળિયં, ઉધના ગામ, સુરત. મો.નં.૮૦૮૧૪૧૦૬૮૬	
૬૫	શ્રી સુરસિંહ જવાનસિંહ સોલંકી કર્મ. નં. ૮૪૮૬૭૮	પ્રા. હે. વ.	૭૮, વિનાયકનગર ગેટ નં.૨, ૧૨૦ ફુટ બમરોલી રોડ, પાંડેસરા, સુરત. મો.નં. ૭૩૫૬૬૪૦૨૬૬	સ્મેક સેન્ટર (આઈ.એસ.ડી.) ખાતે ફબજ બજાવે
૬૬	શ્રી હર્ષદભાઈ ધીરુભાઈ મકવાણા, કર્મ. નં. ૮૪૮૬૭૯	પ્રા. હે. વ.	૩૩-બી, ધૂવતારક સોસા., વેડ રોડ, કનારગામ, સુરત મો.નં.૭૬૮૮૭ ૩૭૬૭૨	
૬૭	શ્રી મુકેશભાઈ અર્જુનભાઈ પગી કર્મ. નં. ૮૪૮૬૮૨	પ્રા. હે. વ.	ઘર નં.૨૩૪, અરુણોદય સોસા., બમરોલી રોડ, પાંડેસરા, સુરત. મો.નં.૮૫૧૦૫૭૭૨૫૬	
૬૮	શ્રી ભારતીબેન નિતિનકુમાર સોલંકી, કર્મ. નં. ૮૪૮૬૮૪	પ્રા. હે. વ.	જે-૩, પંચશીલ એપાર્ટમેન્ટ, અલાયાની વાડી, મહીધરપુરા, સુરત. મો.નં.૮૬૮૭૧૬૭૪૧	
૬૯	શ્રી વિપુલભાઈ મકોડભાઈ જોધી, કર્મ. નં. ૮૪૮૬૮૫	પ્રા. હે. વ.	ઘર નં.૧૪૫, વર્ષા સોસા.-૧, માતાવાડી, વરાણી, સુરત. મો.નં.૮૭૨૪૨૧ ૩૦૫૧	
૭૦	શ્રી પંક્તિકુમાર શરદભાઈ નાયક, કર્મ. નં. ૮૪૮૬૮૫	પ્રા. હે. વ.	સી-૩૦૨, સંગીની ગાઈનીયા, દાંસી રોડ, જહાંગીરાબાદ, સુરત. મો.નં.૮૫૩૭૫ ૮૬૭૧૨	
૭૧	શ્રી તેજશકુમાર રમણભાઈ ટંડેલ કર્મ. નં. ૮૪૮૪૦	પ્રા. હે. વ.	મુ.પો. : ભાગલ, તો.જી. વલસાડ (મંદિર ફળિયા) પીન કોડ નં.૩૮૬૩૮૫. મો.નં. ૮૭૮૦૬૬૨૧૫૪	બેગમપુરા યુનિટ (સેન્ટ્લઝોન) ખાતે ૬૨૪ બજાવે
૭૨	શ્રી હિરણ્યકુમાર અર્જુનસિંહ ટાકોર, કર્મ. નં. ૮૪૮૪૧	પ્રા. હે. વ.	મુ:બલકસ,પોસ્ટ : ચોયડ,તા.ઓલપાડ,જી.સુરત, પીન નં.૩૮૪૫૪૦ મો.નં.૮૭૨૩૮૧૪૦૫, ૬૬૨૪૬૬૭૧૬૪	

૭૩	શ્રી સહદેવ અંબાલાલ પઢીયાર કર્મ. નં. ૪૮૫૪૨	પ્રા.ડે. વ.	૧૨૧, શક્તિનગર સોસા., ભરથાણા (કોસાડ) તા. ચોરાંશી, જી. સુરત, પીન નં. ૩૮૪૧૦૭, મો.નં. ૮૭૩૭૧૮૫૫૮૦	
૭૪	શ્રી રોબિનકુમાર રમેશભાઈ પટેલ, કર્મ.નં. ૪૮૫૪૩	પ્રા.ડે. વ.	ખેડવાયા સ્ટ્રીટ, નવા મગદલા, ડુમસ રોડ, સુરત, પીન નં. ૩૮૫૦૦૭. મો.નં. ૮૭૨૫૦૪૧૦૮૮, ૭૫૬૭૨૨૧૮૬૧	
૭૫	શ્રી ઉમ્રિલાબેન નરેન્દ્રકુમાર પરમાર, કર્મ.નં. ૪૮૫૪૪	પ્રા.ડે. વ.	૨/૨૭૧૩ ગીતાનગર, નડીયાવાસ, સગરામપુરા પુતળી, સુરત. મો.નં. ૮૮૮૮૭ ૩૨૩૨૧	ઉત્તર યુનિટ (સેન્ટ્રલઝોન) ખાતે ૫૨૪ બજાવે
૭૬	શ્રી અંકિતભાઈ ચીમનભાઈ મહેતા કર્મ.નં. ૪૮૫૪૫	પ્રા.ડે. વ.	મુ.બીલખરી, પટેલ ફિલ્યા, તા. મહેવા જી. સુરત, મો.નં. ૭૮૮૦૪૭૮૧૫૭, ૮૧૪૦૫૪૨૪૫૮	
૭૭	શ્રી ઘર્ણેન્દ્રકુમાર નરેન્દ્રભાઈ જોધી, કર્મ.નં. ૪૮૫૪૬	પ્રા.ડે. વ.	ઘર નં. ૭૨/બી, જલારામ નગર, છત્રપતી શિવાજી સ્કુલની પાસે, હરિનગર-૧, ઉધના, સુરત મો.નં. ૮૮૧૩૨૧૫૨૫૦, ૮૧૫૫૦૦૬૫૭૦	
૭૮	શ્રી શૈલેષભાઈ વીસાભાઈ ચુડાસમા, કર્મ.નં. ૪૮૫૪૭	પ્રા.ડે. વ.	ઘર નં. ૮, સોહમ એપાર્ટ., શ્યામ નગર સોસા., નવાગામ, કામરેજ ચાર રસ્તા, પીન નં. ૩૮૫૦૦૭. મો.નં. ૮૭૨૪૦૨૩૮૩૬	
૭૯	શ્રી સૌરભ વિનોદભાઈ પટેલ કર્મ.નં. ૪૮૫૪૮	પ્રા.ડે. વ.	ફ્લેટ નં. ૫, અશોક એપાર્ટ., કૃષ્ણકુંજ સોસા., પાલનપુર પાટીયા, સુરત. મો.નં. ૭૮૮૩૪૬૭૮૦૨	
૮૦	શ્રી માલદે વજરાંગભાઈ વાઢીયા કર્મ.નં. ૪૮૫૪૯	પ્રા.ડે. વ.	ઘર નં. ૭, સોહમ એપાર્ટ., શ્યામનગર સોસા., નવાગામ, કામરેજ ચાર રસ્તા, પીન કોડ નં. ૩૮૫૦૦૭, મો.નં. ૮૧૪૧૮૭૮૩૮૭, ૮૨૬૫૫૪૪૮૦૧	
૮૧	શ્રી ભરતકુમાર શાંતિલાલ નાઈ કર્મનં. ૪૮૫૫૦	પ્રા.ડે. વ.	૭૮, શિવશક્તિ સોસાયટી, રણજિતાંગ સોસાયટીની પાસે, બોમ્બેમાર્કેટ થી પુણ્ણાગામ રોડ, સુરત-૩૮૫૦૧૦ મો.નં. ૮૭૨૬૬ ૭૬૭૪૪	
૮૨	શ્રી દિવ્યેશકુમાર ભરતભાઈ પટેલ, કર્મ.નં. ૮૮૮૯૨	પટાવણા	૫૬, પટેલ ફિલ્યા, મુ.પો. કસાદ, તા. ઓલપાડ, જી. સુરત. મો.નં. ૭૫૬૭૨૧૬૬૮૮	
૮૩	શ્રી બાલુભાઈ મંથુભાઈ પરમાર, કર્મ.નં. ૭૯૧૦	બેલદાર	૮૫, શ્રીજી નગરી, ઉગત, ભેસાણ રોડ, સુરત. મો.નં. ૮૬૦૧૬ ૫૫૬૬૩	
૮૪	શ્રી અરૂણ ગોવિંદભાઈ શર્મા કર્મ.નં. ૧૪૦૨૮	બેલદાર	૧૧૮, રણાંદજી પાર્ક સોસાયટી, કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે, કતારગામ, સુરત. મો.નં. ૮૪૨૬૭૭૪૨૭	પી.એસ.યુ. લેબમાં ૫૨૪ બજાવે
૮૫	શ્રી નરેશભાઈ ચીમનલાલ વૈધ કર્મ.નં. ૧૪૦૭૮	બેલદાર	૧૨૧, સાંચિઆશિષ સોસાયટી, ઉત્ત્રાંશ સ્ટેશનની સામે, જૂનો કોસાડ રોડ, અમરોલી, મો.નં. ૭૫૬૭૧ ૪૫૪૫૮, ૮૭૧૨૫ ૨૮૬૦૮	દુંભાલ સ્ટોર ખાતે ૫૨૪ બજાવે
૮૬	શ્રી અચ્યુતકુમાર નટવરલાલ પટેલ, કર્મ.નં. ૧૭૬૮૮	બેલદાર	૩૦૬, અમીધારા એપાર્ટમેન્ટ, રધુવીર સોસાયટી, કોસાડ રોડ, અમરોલી મો.નં. ૮૮૨૫૨ ૮૮૦૫૭, ૮૮૨૫૨ ૮૮૦૫૭	પી.એસ.યુ. લેબમાં ૫૨૪ બજાવે
૮૭	શ્રી ગિરીશકુમાર દુર્લભભાઈ પટેલ, કર્મ.નં. ૧૮૫૪૧	બેલદાર	૪૮, વિશ્વકર્મા સોસાયટી, રામનગર, રાંદેર રોડ, સુરત. મો.નં. ૮૮૨૭૦ ૪૫૧૭૭	પી.એસ.યુ. લેબમાં ૫૨૪ બજાવે
૮૮	શ્રી રણજીતભાઈ રવિયાભાઈ પટેલ, કર્મ.નં. ૧૮૬૮૧	બેલદાર	૩૪, રણજીતભાઈ પાર્ક સોસાયટી, રામનગર, રાંદેર રોડ, સુરત. મો.નં. ૮૮૦૩ ૦૭૪૦૦	દુંભાલ સ્ટોર ખાતે ૫૨૪ બજાવે
૮૯	શ્રી હેમંતકુમાર ગોવિંદભાઈ શર્મા, કર્મ.નં. ૧૮૭૬૬	બેલદાર	૩૦૭, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, મોરાભાગણ ચાર રસ્તા, રાંદેર, સુરત. મો.નં. ૮૪૬૦૦ ૫૫૫૫૭	
૯૦	શ્રી વિનોદભાઈ રૂડાભાઈ વીરાસ, કર્મ.નં. ૩૪૧૦૮	બેલદાર	૩૦૧, ગોતાલાવાડી, ટેનામેન્ટ, કતારગામ, સુરત. મો.નં. ૮૪૨૮૮૪ ૫૨૫૫૪	
૯૧	શ્રી નીતીનભાઈ મુળજીભાઈ હરીજન, કર્મ.નં. ૩૮૦૪૧	બેલદાર	૧૮, હુલ્બનગર, નવાગામ, ડીડોલી રોડ, ઉધના, સુરત મો.નં. ૮૭૨૪૦ ૮૦૩૨૨, ૮૮૮૦૧ ૧૧૪૮૭	
૯૨	શ્રી અમિતકુમાર દલસુખભાઈ વાઢીલા, કર્મ.નં. ૩૮૧૦૫	બેલદાર	૮૪, મહેશ્વરીપાર્ક સોસા.પરવટ ગામ, ગોડારા રોડ, બોમ્બે માર્કેટ, સુરત. મો.નં. ૬૩૫૨૭૧૨૦૩	
૯૩	શ્રી વિનોદ ડાહ્યાભાઈ બારોટ કર્મ.નં. ૩૮૫૦૨	બેલદાર	૨૫, હરીદર્શન સોસાયટી, નવો કોસાડ રોડ, અમરોલી, સુરત. મો.નં. ૮૮૭૭૮૦ ૪૪૫૭૫	જાહેર ઓરોગ્ય ખાતુ
૯૪	શ્રી સંજ્ય હરીશભાઈ પવાર કર્મ.નં. ૩૮૫૦૧	બેલદાર	૨૨૨, રાશી રેસેડેન્સી, ગામ : ગંગાધરા, તા. પલસાણા, જી. સુરત. મો.નં. ૮૦૧૬૮૭૧૪૦૭	દુંભાલ સ્ટોર ખાતે ૫૨૪ બજાવે
૯૫	શ્રી શૈલેશ કેશુભાઈ પડાય કર્મ. નં. ૩૮૪૭૫	બેલદાર	ગંગાનાથ મહાદેવ મંદિર પાસે, રૂદ્રપુરા, જુની પોલીસ લાઈનની બાજુમાં, સુરત. મો.નં. ૮૭૧૨૮૮૮૫૫૪	
૯૬	શ્રી અજ્યપુરકુમાર ચંપકલાલ ટેન્યા કર્મ.નં. ૪૨૭૨૫	બેલદાર	૫૨- રામપુરા ગાર્ડન મીલની સામે, કાજીપુરા, ચુંમાલીસ ચાલ, હરિજન વાસ, સુરત મો.નં. ૮૮૭૭૮૦ ૮૧૮૩૨	પી.એસ.યુ. લેબમાં ૫૨૪ બજાવે

૮૭	શ્રી શૈલેષકુમાર નટવરલાલ કટારીયા, કર્મ નં. ૭૦૪૨૧	તાલીમાર્થી બેલદાર	૧૨૭, હરીજનવાસ, એરથાણ, તા. ઓલપાડ, જી. સુરત-૩૮૫૫૪૦. મો.નં. ૭૭૫૮૧ ૮૯૩૬૦, ૬૭૧૨૭ ૮૧૫૮૮	
૮૮	શ્રી ભાવેશ રમેશચંદ્ર અજમેરી કર્મ નં. ૭૦૪૨૭	તાલીમાર્થી બેલદાર	૫૮, ગીરનાર સોસાયટી, છાપરાભાડા, અમરોલી, સુરત-૩૮૪૧૦૭. મો.નં. ૮૭૨૬૬૮ ૮૬૩૩૨, ૬૭૫૨૭ ૦૬ ૩૮૮	
૮૯	શ્રી અવિનાશ શિવાજી પાટીલ કર્મ નં. ૭૦૪૪૬	તાલીમાર્થી બેલદાર	૫૮, મહાપ્રભુનગર, સર્વે નં. ૨૧/૨, સેવન-૩ સ્કુલની ગલીમાં, લીલાયત, સુરત. મો.નં. ૮૨૬૫૦ ૮૭૮૦૧, મો.નં. ૮૭૨૨૪ ૮૨૨૩૮	
૧૦૦	શ્રી પંકજભાઈ નરસિંહભાઈ પટેલ કર્મ નં. ૭૦૪૫૨	તાલીમાર્થી બેલદાર	અભે-૨૩, સાંઈ રેસીઝેન્સી, દિવા રોડ, અંકલેશ્વર. ૬૮૦૫૬ ૪૭૮૫૨	
૧૦૧	શ્રી સુનીલ રघુનાથ પવાર કર્મ નં. ૭૦૪૬૨	તાલીમાર્થી બેલદાર	૮૧, ગલી નં. ૨, સિદ્ધાથ નગર, તનુ ગેસ એજેન્સીની પાસે, ભેસ્તાન નહેર, જીઅવ, ભેસ્તાન, સુરત-૩૮૫૦૨૩. મો.નં. ૮૮૬૬૫ ૨૧૨૬૫, ૬૭૭૩૦ ૮૦૩૦૮	
૧૦૨	શ્રી અલ્પેશકુમાર વશરામભાઈ સોલંકી, કર્મ નં. ૭૦૪૬૭	તાલીમાર્થી બેલદાર	૧૫૪૬, ગાયત્રીનગર સોસાયટી, છાપારાભાડા રોડ, અમરોલી, સુરત. મો.નં. ૮૮૮૮૮૮ ૩૭૫૪૭, ૮૧૬૦૬ ૩૬૫૦૪	
૧૦૩	શ્રી વૃંઘાકુમાર વિજયકુમાર ખરસાડીયા, કર્મ નં. ૭૦૪૭૨	તાલીમાર્થી બેલદાર	૫/૧૨૫, એ-ખાહમજા ફિલ્યુ, રાંદેર જીમખાના, સુરત-૩૮૫૦૦૫. મો.નં. ૮૫૧૦૫ ૭૦૭૪૭, ૮૨૦૦૭ ૮૪૮૧૪	
૧૦૪	શ્રી પ્રજોશકુમાર પરભુભાઈ પટેલ કર્મ નં. ૭૦૪૭૫	તાલીમાર્થી બેલદાર	૧૬૪, ટેકરા ફિલ્યું, ઉંબેર, તા. ચોર્યાસી, જી.સુરત. મો.નં. ૮૭૨૬૬ ૩૭૮૪૦	
૧૦૫	શ્રી વિશાળકુમાર ધનરાજભાઈ પટેલ, કર્મ નં. ૭૦૪૭૬	તાલીમાર્થી બેલદાર	૧/૨૬, પ્રજાપતિ મહોલ્લો, મોટી વેડ, સુરત સીટી, સુરત-૩૮૫૦૦૪ મો.નં. ૮૭૧૨૮ ૪૭૪૧૪, ૮૧૬૦૪ ૪૫૮૮૩	
૧૦૬	શ્રી દર્શાવકુમાર રમણીકભાઈ રગાંધી. કર્મ નં. ૭૦૮૮૪	તાલીમાર્થી બેલદાર	૪૩, કૃષ્ણ નગર સોસાયટી, અંડાનાનંદ કોલેજની પાસે, વેડ રોડ, સુરત-૩૮૫૦૦૪ મો.નં. ૬૩૫૧૬ ૧૫૮૫૦	
૧૦૭	શ્રી પ્રશાંતકુમાર ગૌતમભાઈ શિંદે કર્મ નં. ૭૨૮૬૧	તાલીમાર્થી બેલદાર	૩૨૬, ઈન્ડીરાનગર જુપડપઢી, ભટાર, સુરત. મો.નં. ૮૭૫૮૮૮૮૪૦૧, ૮૫૧૧૮૬૬ ૩૭૫૫	
૧૦૮	શ્રી સાગર મધુકર પાનપાટીલ કર્મ નં. ૭૨૮૬૪	તાલીમાર્થી બેલદાર	૨૪૧-મહાદેવનગર સોસાયટી, નવાગામ-ડીડોલી, સુરત મો.નં. ૮૮૬૬૨૮૦૮૨૧	
૧૦૯	મોહમદ કાસિમઅભયારહુસેન કાદીર કર્મ નં. ૭૨૮૬૫	તાલીમાર્થી બેલદાર	૩૩, શુકુન ટેનામેન્ટ, અલફેસાની સ્કુલ પાસે, ન્યૂ રાંદેર રોડ, સુરત. મો.નં. ૭૦૮૬૫ ૮૦૦૮૩	
૧૧૦	શ્રી હીતેશકુમાર કંલેશભાઈ પટેલ કર્મ નં. ૭૨૮૬૮	તાલીમાર્થી બેલદાર	મોર ભગવા, તા. ઓલપાડ, જી.સુરત ૮૫૧૧૦૮૦૦૬ ૩	
૧૧૧	શ્રી અબ્દુલસાજીદ અજીજ શેખ કર્મ નં. ૭૨૮૬૯	તાલીમાર્થી બેલદાર	૩/૩૦૨૪, અકબર શહીદ, પઠાણવાડ, રૂસ્તમપુરા પોલીસ ચોકી પાસે, સુરત. મો.નં. ૭૩૮૩૪૩૩૦૫૦	
૧૧૨	શ્રી કૃષ્ણાલકુમાર ચમનલાલ ભાસ્કર કર્મ નં. ૭૨૮૭૦	તાલીમાર્થી બેલદાર	૫૫, ગાંધીનગર સોસાયટી, સિંગણોરગામ, સુરત-૩૮૫૦૦૪. મો.નં. ૭૦૮૬૬૯૨૧૧૬૪	
૧૧૩	શ્રી પ્રિયાંશુ યોગેશ મોરે કર્મ નં. ૭૩૧૩૭	તાલીમાર્થી બેલદાર	૮૨/૮૩, માધવપાર્ક રો-હાઉસ, પાલનપુર જીકાતનાકા, અડાજણ, સુરત-૩૮૫૦૦૫ મો.નં. ૭૪૦૫૧૫૫૩૭૬	પી.એસ.યુ. લેબમાં ૬૨૪ બજાવે
૧૧૪	શ્રી જયેશકુમાર મહેશભાઈ નાયકા, કર્મ નં. ૮૮૮૦૩	તાલીમાર્થી બેલદાર	૧૭૭, મહાદેવનગર કોલોની, હરિ ચંપા પાસે, અડાજણ, સુરત-૩૮૫૦૦૮ મો.નં. ૬૫૧૦૧૪૩૩૩૫	સ્મીમેર હોસ્પીટલ ખાતે ૬૨૪ બજાવે
૧૧૫	શ્રી જીતેન્દ્ર ગમનભાઈ પટેલ કર્મ નં. ૮૮૮૧૭	તાલીમાર્થી બેલદાર	બીલીગ નં.૦ ૮, રૂમ નં.૮, ડેક્ટરપાર્કની બાજુમાં, જહાંગીરપુરા, સુરત. મો.નં. ૬૩૫૧૬ ૧૫૮૫૦	

સેક્રેશન ઓફિસર  
વી.બી.ડી.સી.વિભાગ